



JAINSITE E-BOOKS LITERATURE

**JAIN HISTORY • JAIN GRANTH • JAIN SUTRA
JAIN VIDHI • JAIN STORY • JAIN ASTROLOGY**

And Many More Books in Gujarati, Hindi & English

જैનસાઇટ ઈ-બુક્સ લિટરેચર ના સંપૂર્ણ લાભાર્થી

શ્રી શૈવાભૂર મૂર્તિપૂજક જૈન સંઘ, અંધેરી (પૂર્વ)

પાર્શ્વદર્શન બિલ્ડિંગ, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણા રોડ,
(જુના નાગરદાસ રોડ), અંધેરી (પૂર્વ), મુંબઈ - 400 066.



www.jainsite.com

Blessings : **P. P. PANYAS SHREE NIPUNCHANDRA VIJAYJI M. S.**

Inspired by : **MUNI BHAGYACHANDRA VIJAYJI M. S.**

Created by :



E-mail: info@jainsite.com • Tel.: 09867711171

॥ॐ श्री शंखेश्वर पार्श्वनाथाय नमः ॥

जैन ई-बुक्स ना संपुर्ण लाभार्थी
श्री शेत्काम्बर मूर्तिपूज्ञ जैन संघ, अंधेरी (पूर्व)



श्री शंखेश्वर पार्श्वनाथ जैन मंदिर



॥ ઊં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ॥

દ્રસ્ટની નોંધણી નં. F-4210 (BOM)

સોસાયટીની નોંધણી નં. Bombay 381/1976 G.B.B.S.D.

શ્રી શૈતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અંધેરી (પૂર્વ)

પાર્શ્વદર્શન બિલ્ડિંગ, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણા રોડ, (જુના નાગારદાસ રોડ),
અંધેરી (પૂર્વ), મુંબઈ - ૪૦૦ ૦૬૮.

પ્રસ્તાવના

અનેક પરમોપકારક આચાર્ય દેવ જ્ઞાની, તપસ્વી મુનિરાજ, સેવાભાવી સાધ્વીજી ભગવંતોના અભિતિય-અદ્ભૂત-અવર્ણાનીય આશીર્વાદથી તથા મહાપવિત્ર મંત્રોચ્ચાર અને વિદ્યિ વિધાન દ્વારા સ્થાપિત આકર્ષક અલૌકિક અને અનેક મનમોહક રૂપમાં ભગવાન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી મનોરમ્ય, નેત્ર દિપક લાવણ્યમય પ્રતિમાજીને મૂળનાયક તરીકે બિરાજમાન કરેલ દેવવિમાન તુલ્ય તીર્થસમ જિનાલય એટલે મારું-તમારું અને આપણા સહૃદુનું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનું શિખરબંધી જિનાલય તથા ધીર-વીર-ગંભીર-સરળ-ભક્તિ-ધાર્મિક પાપભીર દાનવીર અને ઉત્તમોત્તમ શ્રાવક-શ્રાવિકાઓથી બનેલો રૂપમાં તીર્થકર તરીકે ઓળખાતો શ્રી શ્રી. મૂ. જૈન સંઘ, અંધેરી (પૂર્વ) એટલે અમારો શ્રી અને સરસ્વતીથી સભર બનેલો વિનયી-વિવેકી અને ગુરુભગવંતોનો કૃપાપાત્ર બનેલ ચારે તરફ એ દશો દિશાઓમાં જૈનમૂળ જ્યાતિ શાસનમૂળ ની યશોગાથા નો વિજયદોષ ૧૪ રાજલોકમાં ગુંજતો કરનાર એટલે અમારો શ્રી શ્રી. મૂ. જૈન સંઘ અંધેરી (પૂર્વ) અનેક નાના મોટા ધાર્મિક અનુષ્ઠાનો કરનાર શ્રી સંઘોને મદદરૂપ બનનાર, અનેક પાંજરાપોળોને સહાયભૂત થનારો અનેક સાધુ-સાધ્વીજી ભગવંતોના વૈચાવચ્ચયમાં સદાય અગ્રેસર, ગૃહ જિનાલયમાંથી શરૂ થયેલ આજે ઉત્તુંગ ગગનચુંબી આકર્ષક શિખરબંધી જિનાલય જેમાં દેવ-દેવીઓની દેવકુલિકાઓ શોભી રહી છે. શ્રી સંઘમાં કાયમી આયંબિલ ખાતું-બે બે પાઠ્શાળાઓ, જ્ઞાનભંડાર એટલે શ્રી સંઘ શક્તિનું નમૂનેદાર નજરાણું કહેવાય.

યુગાદિવાકર પ. પૂ. ઉપકારી ગાંધીજિના નાયક આ. ભ. શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મ. સા. ની શુભ પ્રેરણા. માર્ગદર્શક તથા તેમની શુભ નિશ્ચામાં નિર્ભિત અને સ્થાપિત શ્રી જિનાલય તથા પ. પૂ. શતાવધાની આ. ભ. શ્રી જયાનંદસૂરીજીની પ્રેરણાથી તા. ૪-૪-૧૯૭૬ માં શ્રી સંઘની સ્થાપનાના સુંદર વિચારોનું બીજ આજે ઘેઘુરો ઘટાદાર વૃક્ષ સમાન બન્યો છે. ચમત્કારી અને અલૌકિક મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરીને જૈન-જૈનતરોની દ્રષ્ટાઓ ફળીભૂત થઇ છે.

નિસહાય-અભોલ બનેલા ટોરોની અને પાંજરાપોળોને અમારા શ્રી સંઘે ઉદાર હાથે મદદ કરી છે તથા હાલમાં કેળવણી ક્ષેત્રે, મેડીકલ ક્ષેત્રે, સાધર્મિક ક્ષેત્રે, અનુકર્પા ક્ષેત્રે પણ શ્રી સંઘની જ એક શાખા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ફાઉન્ડેશન દ્વારા આર્થિક સહાય ચાલુ છે.

શ્રી શ્રી. મૂ. જૈન સંઘ વતી

પ્રમુખ

શ્રાવક-શ્રાવિકાના જીવનને માટે
ઉપયોગી નિયમો સહિત

સમ્યકૃત્વ મૂલ બાર્ષિક

જૈન સાઇટ
JAIN SITE
.com

જૈનમ् જ્યાતિ શાસનમ्



વિવેચક :

ધીરજલાલ ડાખાલાલ મહેતા





શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ

શ્રાવક-શ્રાવિકાના જીવનને
માટે ઉપયોગી નિયમો સહિત

સમ્યક્ત્વ મૂલ બાચ્વત

સમ્યક્ત્વ તથા બાચ્વતનું વિવેચન,
તેમાં આવતા જરૂરી કેટલાક નિયમો,
ગુણવંદન, ચૈત્યવંદનનાં સૂત્રો તથા
સવાર-સાંજનાં ઉપયોગી પચ્યક્ખાણો

વિવેચક :

ધીરજલાલ ડાલ્ખાલાલ મહેતા.

પ્રકાશક :

શ્રી લૈનધર્મ પ્રસારણ ટ્રસ્ટ

૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે,
અડાજણ પાટીયા, સુરત-૩૬૫ ૦૦૮. (ગુજરાત)

ફોન : (૦૨૬૧) ૨૬૮૮૫૪૩

શ્રી જૈનધર્મ પ્રસારણ ટ્રસ્ટ



૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે,
અડાજણ પાટીયા, સુરત-૩૮૫ ૦૦૮. (ગુજરાત)
ફોન : (૦૨૬૧) ૨૬૮૮૮૪૩

મૂલ્ય રૂ. ૨૫-૦૦



વિકલ્પ સંવત
૨૦૫૮

વીર સંવત
૨૦૨૮

ઈસ્વીસન
૨૦૦૨

પ્રથમ
આવૃત્તિ

ધીરજલાલ ડાહાલાલ મહેતા

૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ
પાસે, અડાજણ પાટીયા, સુરત-૮. (ગુજરાત)
(INDIA) ફોન : (૦૨૬૧) ૨૬૮૮૮૪૩

યશોવિજયજી લેન સંસ્કૃત પાઠ્શાળા

સ્ટેશન રોડ, રંગમહોલના નાકે, મહેસાણા
(ઢ.ગુજરાત) (INDIA) ફોન : ૫૧૩૨૭

સરસ્વતી પુરુતક ભાડાર

હાથીખાના, રેતનપોળ, અમદાવાદ-૧.
(INDIA) ફોન : (૦૭૯) ૫૩૫૬૬૮૮

સેવંતીલાલ વી. લેન

૨૦, મદાજન ગલી, ઝેવેરી બજાર, મુંબઈ-૨.
(INDIA) ફોન : (૦૨૨) ૨૪૦૪૭૧૭.

સુધોષા કાર્યાલય

શેખનો પાડો, ઝેવેરીવાડ સામે, અમદાવાદ-૧
(INDIA) ફોન : (૦૭૯) ૨૧૩૧૪૯૮

'ભરત ગ્રાફિક્સ' ક્યુમાર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ,

અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન : ૨૧૩૪૭૬૬, ૨૧૨૪૭૨૩

અમારા લખાયેલા પ્રકાશિત થયેલા પુસ્તકો

૧. યોગવિશિકા :- ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે.
ગુજરાતી સરળ વિવેચન.
૨. યોગશાસ્તક :- સ્વોપ્નશાસ્તકીકા તથા ટીકાના અનુવાદ સાથે.
ગુજરાતી સરળ વિવેચન.
૩. શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાંત :- નવકારથી
સામાઈપવયજુંતો સુધીના સૂત્રો ઉપર વિવેચન. નવતત્ત્વ,
ચૌદ ગુણસ્થાનકો, કર્મના ૧૫૮ બેદો, સાત નયો,
સત્તબંગી અને ડાલાદિ માંચ સમવાદી કારણો ઉપર
સરળ ગુજરાતી વિવેચન.
૪. શ્રી જૈન તત્ત્વ મ્રકાશ :- દેવસી-રાંનજિન, પ્રતિકમણનાં
સૂત્રો ઉપર સરળ ગુજરાતી વિવેચન.
૫. જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોષ :- જૈન શાસ્ત્રોમાં
વારંવાર વપરાતા પારિભાષિક ધાર્મિક શબ્દોના અર્થો,
ધાર્મિક શબ્દકોશ.
૬. જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા :- પ્રૌઢ સ્ત્રી-પુરુષોને
ઉપયોગી ચારસો પ્રશ્ન-ઉત્તરોનો સુંદર સંગ્રહ.
૭. પ્રયમ કર્મગ્રન્થ (કર્મવિપાક) :- સરળ ગુજરાતી વિવેચન.
૮. દ્વિતીય કર્મગ્રન્થ (કર્મસ્તવ) :- સરળ ગુજરાતી વિવેચન.
૯. દૃતીય કર્મગ્રન્થ (બંધસ્ત્વામિત્વ) :- સરળ ગુજરાતી વિવેચન.
૧૦. ચતુર્થ કર્મગ્રન્થ (ધડશીતિ) :- સરળ ગુજરાતી વિવેચન.

- ૧૧. પૂજા સંગ્રહ સાર્થ :-** પંચકલ્યાણક, અંતરાયકર્મ નિવારણ, પિસ્તાલીસ આગમની પૂજા આદિ પૂજાઓ સુંદર ભાવવાડી અર્થ સાથે.
- ૧૨. સ્નાત્રપૂજા સાર્થ :-** પૂ. વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા અર્થ સાથે.
- ૧૩. સમ્યક્ષ્ટવના સડસઠ બોલની સજ્ગાય :-** ઘડી જ રોચક કથાઓ સાથે તથા સમ્યક્ષ્ટવ સપ્તતિકાની ગાથાઓ સાથે સડસઠ ગુણોનું વર્ણન.
- ૧૪. નવસ્મરણ :-** મૂળ ગાથાઓ, ગુજરાતીમાં ગાથાઓના સરળ અર્થ, હંગલીશમાં મૂળ ગાથાઓ અને હંગલીશમાં તે ગાથાઓના અર્થ.
- ૧૫. રલાકરાવતારિકા (ભાગ-૧) :-** પ્રમાણનયતત્વાલોક ઉપરની પૂ. રલાપ્રભાયાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતીમાં અર્થ. (પરિચ્છેદ ૧-૨)
- ૧૬. રલાકરાવતારિકા (ભાગ-૨) :-** પૂ. વાદિદેવસૂરિજી રચિત પ્રમાણનયતત્વાલોક ઉપરની પૂ. રલાપ્રભાયાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતીમાં અર્થ. (પરિચ્છેદ ૩-૪-૫)
- ૧૭. આઠ દસ્તિની સજ્ગાય :-** પૂ. ઉપાધ્યાય શ્રી યશો-વિજયજી મ. સા. કૃત આઠ દસ્તિની સજ્ગાયના સરળ ગુજરાતી અર્થો.
- ૧૮. યોગદસ્તિ સમુચ્ચયાય :-** પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત સ્વોપ્રજી ટીકા સાથે ટીકાનું અતિશય સરળ ગુજરાતી વિવેચન.

૧૯. પંચમ કર્મગ્રન્થ (શતક) :- ગુજરાતી સરળ વિવેચન સહ.
૨૦. તત્ત્વાર્થાધિગમ સૂત્ર :- સૂત્રોનું સરળ, રોગક તથા સંક્ષિપ્ત વિવેચન.
૨૧. શ્રી વાસ્તુપૂજા સાર્થ :- પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી કૃત પૂજાનું સુંદર-સરળ તથા જૈન વિધિ સહ ગુજરાતી ભાષાંતર.
૨૨. શ્રી સમ્યક્ષત્વ મૂલ બાચ્ચવત :- વિવેચન સહ.

નીચેના ગ્રન્થોના અર્થો લખવાની ભાઘના છે.

૧. દ્રવ્યગુણપર્યાપ્તનો રાસ:- પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કૃત.
૨. સમ્મતિતર્ક :- પૂ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશરજી કૃત.
૩. જૈન દર્શન પરિચય :- જૈન દર્શનને માન્ય તત્ત્વો, આચાર સંહિતા, આત્મવિકાસ ક્રમ, ક્ષેત્ર વિચાર આદિ વિષયોનો સુંદર પરિચય.
૪. શ્રી સવાસો ગાથાનું સત્ત્વન : - વિવેચન સહ.

શ્રાવક-શ્રાવિકાના જીવન માટે નિયમો જરૂરી

સંસારની ચાર ગતિમાંથી ધર્મની આરાધના કરી આત્મકલ્યાણ કરી શકીએ એવો માનવનો જ એક ભવ છે, અનંત પુષ્યાઈએ આ જીવની પ્રાપ્તિ થાય છે. તેમાં પણ આર્થિકશ, આર્થિકુલ અને જૈનધર્મની પ્રીતિવાણ ઘરોમાં જન્મ થવો વધારે દુષ્કર છે. જન્મ થયા પછી જૈનધર્મ ગમી જવો, રૂચિ જવો તે વધારેમાં વધારે દુષ્કર છે. આપણો આ બધું પામ્યા જ છીએ, આટલી ઉચ્ચી સ્થિતિ પામીને પાપ-પુષ્યને જાણવું જોઈએ. બીજાજરૂરી પાપોનો જીવનમાંથી ત્યાગ કરવો જોઈએ. જો સમજી શોચીને પાપોનો ત્યાગ ન કર્યો હોય તો તે પાપોની સાથેનો સંબંધ છોડ્યો નથી તેથી પાપો ન કરવા છતાં તે પાપોનો આશ્રવ ચાલુ જ રહે છે.

... ભાડે લીધેલું ઘર હોય, અને કોઈ કારણવશાત્તુ બે-ચાર માસ રહેવા ન જઈએ તથા તે મકાનનો ઉપયોગ ન કરીએ તો પણ બે-ચાર મહિને ભાડાવાળો આવે જ. અને ભાડુ આપવું જ પડે. મકાનનો વપરાશ ભલે કર્યો નથી પરંતુ સંબંધ ત્યજ્યો નથી. તેથી ભાડુ આપવું જ પડે છે, તેમ અહીં પાપોનું સેવન ન કરવા છતાં પચ્ચક્ખાણ લઈને તેનો સંબંધ છોડ્યો ન હોય તો પાપોનો આશ્રવ ચાલુ જ રહે છે.

એવાં કેટલાંય પાપો છે કે જે શ્રાવક-શ્રાવિકાના જીવનમાં કરાતાં નથી. જેમકે મદિરાપાન, માંસભક્ષણ, શિકાર, પરસ્ત્રીગમન વિગેરે. પરંતુ આ પાપો ન કરવાનું જો પચ્ચક્ખાણ ન લીધું હોય તો ભાડાના મકાનની જેમ આશ્રવ ચાલુ જ રહે છે. ઘણા જવો પચ્ચક્ખાણ લેવામાં ડરતા હોય છે કે

પચ્યકુખાણ કરીએ તો જોઈક વખત ભાંગી જાય. ભૂલ થઈ જાય. દોષ લાગી જાય. પરંતુ ભૂલ થઈ જાય તો કરેલું આ પચ્યકુખાણ ભાંગી જતું નથી. કારણ કે પચ્યકુખાણમાં અન્નસ્થળાભોગેણ સહસાગારેણ વિગેરે આગારો (દુટ) છે. જે કંઈ નાની-મોટી ભૂલ થઈ તેનાથી અતિચાર (દોષ) લાગે છે. તેની આલોચના -પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત્ત દ્વારા નિંદા-ગર્હા કરીને શુદ્ધિ થઈ શકે છે. પરંતુ પચ્યકુખાણ ભાંગી જતું નથી.

“પચ્યકુખાણ કરવું” એ એક બંધન છે. એમ સમજુ કેટલાક લોકો ડરતા હોય છે. પરંતુ ઉત્તમ અને નિર્બય જીવન જીવવા માટે પચ્યકુખાણ કરવું અત્યન્ત જરૂરી છે. કેટલાંક બંધનોથી જીવન નિર્બય બને છે. જેમ કે વેચાડા લીધેલા મકાનના પેસા આપી દીધા હોય અને સ્ટેમ્પ-સિક્કાની (દસ્તાવેજ વિગેરેની) કાર્યવાહી ન કરી હોય તો બય ઉલ્લો જ રહે છે તેથી સ્ટેમ્પ-સિક્કા (દસ્તાવેજ) વિગેરે કરાવવા જ પડે છે તેમ અહીં શ્રાવક અને શ્રાવિકાનું ઉત્તમ જીવન અને નિર્બય જીવન જીવવું હોય તો સમ્યકૃત્પરૂપક શ્રાવક ધર્મનાં બાર પ્રતોના નિયમથી જીવનને દેશવિરતિધર બનાવવું એ જ સંસાર તરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. તેથી સમ્યકૃત્વ અને બારપ્રતોને સમજાવતી આ નાની પુસ્તિકા બનાવી છે. ભગવાનના યતુર્વિધ સંધમાં શ્રાવક-શ્રાવિકા તરીકે આપણું સ્થાન આવે માટે અવશ્ય પ્રતધારી થવું. પરંતુ હરાયા ઢોરની જેમ રખું અને રેઢીયાળ નિયમન વિનાનું જીવન સંસારથી તારનાર પડા નથી અને શોભાસ્પદ પણ નથી. માટે ચાલો આપણે સમ્યકૃત્વ અને બાર પ્રતો વિષે કેટલીક વાતો સમજુએ.

મૂલભૂત સમ્યકૃત્વ પ્રાપ્ત

(૧) સુદેવ સુગુરુ અને સુધર્મને જ માનીશ. પરંતુ કુદેવ-કુગુરુ અને કુધર્મને માનીશ નહીં.

(૨) જે રાગ-દેખાદિ મોહના સર્વભાવો ત્યજીને વીતરાગ-સર્વજ્ઞ કેવળી બન્યા છે. તેવા તથા ૧૮ દૂધણો રહિત દેવને જ સુદેવ તરીકે માનીશ. જે દેવો સ્ત્રીવાળા છે શરૂતો વાળા છે. મોહવાળા છે. **જૈવિકારસાનુસૂચિ** વાસનાથી ઘેરાયેલા છે. તેવા ધર્મના નાયક થઈને બેઠેલા દેવોને પરમાત્મા (દેવ) તરીકે હું સ્વીકારીશ નહીં.

(૩) વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા પ્રમાણે ચાલનારા, સંસારના સર્વથા ત્યાગી, પાંચ મહાપ્રત પાણનારા અને પળાવનારા એવા સાધુ-સાધ્વીજીના વેશમાં વર્તનારા ગુરુને જ સુગુરુ માનીશ. તેમને જ નમન-વંદન કરીશ. પરંતુ પોતાની ઈચ્છા પ્રમાણે ચાલનારા, સંસારના ભોગી, જુદાજુદા મત અને મઠને સ્થાપનારા, કેવળ એકલા વ્યવહારને જ અથવા એકલા નિશ્ચયને જ સ્થાપિને બીજા નયને ઉડાડી ભોળા લોકોને અવળે માર્ગ દોરનારાને હું ગુરુ તરીકે સ્વીકારીશ નહીં. તેમને નમન-વંદનાદિ વ્યવહાર કરીશ નહીં.

(૪) તીર્થીકર દેવોએ બતાવેલ અને મોહને નાશ કરનારા એવા જ્ઞાનને અને મોહનો નાશ કરે એવી કિયાને જ હું

“સુધર્મ” તરીકે સ્વીકારીશ. તેના વિના અન્ય કોઈ પણ મ્રકારના શાનને અને આચરણને હું સુધર્મ તરીકે નહીં સ્વીકારું. આ પ્રમાણે સુદેવ સુગુરુ અને સુધર્મને યાવજ્ઞાવ સ્વીકારીને તેને જ નમન-વંદન-પૂજન કરીશ. આ સમ્યકૃત્વદ્વાત જાણવું. તે વ્રતમાં નીચેના નિયમ યથાશક્તિ પાળીશ. જે જે પાળી શકાય એવા નિયમો છે તેને આવી છે નિશાની કરવી અને જે નિયમો ન પાળી શકાય તેવા છે ત્યાં છે આવી નિશાની કરવી.

દર્શનાચાર :-

૧. હું દરરોજ દેરાસર જઈને ભગવાનનાં દર્શન કરીશ. દેરાસર બહુ દૂર હોય તો ઘરમાં પદ્માવિલા ભગવાનનાં પણ દર્શન કરીશ.
૨. હું દરરોજ પરમાત્માની પૂજા કરીશ. (અભ્યપ્રકારી અથવા યથાયોગ્ય)
૩. પરમાત્માની લક્ષ્ણ નિમિત્તે બંડારમાંરૂપીયા મુકીશ. યોખાનો સાથીયો કરીશ, નવાં નવાં ફળ નૈવેદ્ય ધરીશ. તથા અવસરે અવસરે અંગલુછ્છણાં ધૂપ-દીપ કિરેરે સામશ્રી દેરાસરમાં આપીશ.
૪. આઠ પડવાળો મુખકોશ બાંધીને પૂજા કરીશ. રૂમાલ વાપરીશ નહીં.
૫. ધોતી અને ખેસ પહેરીને પૂજા કરીશ. સ્ત્રીઓએ યથોચિત વેશ સમજી લેવો (ધારી લેવો)
૬. દેરાસરમાં સંસારી વાતો કરવાની, ખાવા-પીવાની,

થુકવાની, લઘુનીતિ^૧-વડીનીતિ^૨ કરવાની વિગેરે આશાતનાઓ કરીશ નહીં.

૭. વર્ષમાં.....સ્નાતપૂજા અવશ્ય ભજાવીશ અને એકાદ વખત ચંચકલ્યાણકાદિની મોટી પૂજા પણ ભજાવીશ.
૮. અવસરે ગામના બધા જ દેરાસરોની ચૈત્યપરિપાઠી કરીશ તથા અવસરે ત્રિગું અને ભંડાર જેવી મોટી વસ્તુ મૂકવાનો લાભ લઈશ. પરમાત્મા પ્રત્યે અને મંહિર પ્રત્યે પ્રેમ રાખી તેની સુરક્ષાનું પણ જરૂર ધ્યાન રાખીશ.
૯. વર્ષમાં શત્રુજય-ગિરનાર-શંખેશર-સમેતશિખર આબુ આદિ જેવાં તીર્થોમાંથી.....તીર્થોની યાત્રા કરીશ. તે તીર્થોની યાત્રા કરતાં પર્વત ઉપર ચડતાં-ઉત્તરતાં બૂટ-ચંપલાદિ પહેરીશ નહીં. થુકીશ નહીં. ઝડો-પેશાબ કરીશ નહીં. રેડીયો, ટેલ્વિઝન નહીં. અર્થાતું તીર્થની આશાતના થાય તેવું અનુચિત કાર્ય કરીશ નહીં.
૧૦. જીવનમાં એકાદ વખત છ'રી પાલિત સંઘમાં જઈશ. જો આર્થિક સંજોગો સારા હશે તો છ'રિ પાલિત સંઘ કાઢીશ. સમ્યકૃતપ્રતની ભાવના વધે તેમ વતીશ.
૧૧. તીર્થસ્થાનમાં રાત્રિબોજન, અભક્ષ્ય ભોજન કે અનંતકાય ભોજન કરીશ નહીં. હાટલનો ઉપયોગ માયઃ કરીશ નહીં. શત્રુજય પર્વત ઉપર દહીં વિગેરે ખાઈશ નહીં.
૧. બાથરૂમ જવું, ૨. ટોપલેટ જવું.

૧૨. જીવનમાં એકાદવાર શાન્તિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર-સિદ્ધયક્પૂજન અને અહૃદી મહોત્સવ જેવા પ્રસંગો કરીશ.
૧૩. દરરોજ સવારે ઉઠતાં અને રાત્રે સૂતાં પહેલાં, ભોજન લેતાં પહેલાં બાર બાર નવકાર ગણીશ. અને કોઈપણ ક્રમકાજ માટે ઘરથી બહાર નીકળતાં પૂર્વ સાત ભયોના નિવારણ અર્થે સાત-સાત નવકાર મંત્ર ગણીશ.
૧૪. વર્ષમાં આવતાં પર્વોને ત્યાગ-તપથી ઉજવીશ. યથાશક્તિ એકાસણું, બેસણું, આયંબિલ, ઉપવાસ કરીને પરમાત્માની ભક્તિ કરવાપૂર્વક આરાધના કરીશ.
૧૫. કુલાચાર પ્રમાણે ગોત્રદેવી તથા કુળદેવીનાં દર્શન-વંદન-તમન કરવાની તથા ગોત્રજ જારવા આદિ વ્યવહારિક કાર્યની જ્યાણા.
- (૧) શાનપંચમી : કારતક સુદ ૫, શાનની આરાધના.
 જનમ્ય જ્યાતિ શાસનમ
- (૨) મૌન એકાદશી : માગશર સુદ ૧૧, મૌન પાળવું.
- (૩) પોષ દશમી : માગશર વદ ૧૦ પાર્શ્વનાથ પ્રભુનું જન્મકલ્યાણક.
- (૪) મેરુ તેરસ : પોષ વદ ૧૩, ઋષભદેવ પ્રભુનું નિર્વાણ કલ્યાણક.
- (૫) મહાવીર જન્મકલ્યાણક : ચૈત્ર સુદ ૧૩, મહાવીર પ્રભુનું જન્મકલ્યાણક.
- (૬) અખાતીજ : વૈશાખ સુદ ૩, વર્ષાતિપના પારણાં.
- (૭) દીવાળી : આસો વદ ૦), મહાવીર પ્રભુ નિર્વાણ કલ્યાણક.

- (૮) ભાસધર : શ્રાવજી સુદ ૪, એક માસ પછી સંવત્સરી.
- (૯) પક્ષધર : શ્રાવજી વદ ૪, પંદર દિવસ પછી સંવત્સરી.
- (૧૦) ત્રણ ચોમાસી : કારતક સુદ ૧૪, ફાગાજી સુદ ૧૪
અને અષાડ સુદ ૧૪. (સુદ ૭ થી સુદ ૧૫
સુધીની અઢાઈ)
- (૧૧) બે ઓળી : ચૈત્ર અને આસોમાં સુદ ૭ થી ૧૫ સુધી.
- (૧૨) પર્યુષલ્લાપર્વ : શ્રાવજી વદ ૧૨થી ભાદરવા સુદ ૧૪.
૧૫. જૈનેતર પર્વોમાં ભાગ લઈશ નહિ. તેમાં ચાલતી પ્રથા પ્રમાણે આચરણ કરીશ **નહિની**. હોળી, ધુળેટી, બળેવ,
રામનવમી, જન્માષ્ટમી, મહાશિવરાત્રિ, દેવ પોઢણી
અગિયારસ, દેવ ઉદ્ઘાટની અગિયારસ વિગેરે મિથ્યાત્ત્વી
પર્વોને માન્ય રાખીશ નહિની. જુગાર રમવાનું કે બાંગ
પીવા આદિનું કાર્ય કરીશ નહિની.
૧૬. મારા જીવન દરમ્યાન યથાશક્તિ પંચાચારનું પાલન
કરીશ. શાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર
અને વીર્યાચાર આ પાંચ આચારો યથાશક્તિ પાળીશ.

શાનાચાર :-

- હું દરરોજ.....કલાક ધાર્મિક સૂત્રો ગોખવાનું, અર્થ
ભાષવાનું અથવા ધાર્મિક પુસ્તક વાંચવાનું કરીશ.
- જ્ઞાનની આરાધના માટે દરરોજ (અથવા.....દિવસ) ૫૧
અથવા ૫ ખમાસમજી આપીશ. એટલા જ સાથીયા કરીશ.

- અને અંદોળીન્મો નાણસ્સ આ પદની ઓછામાં ઓછી
૧ અને વધુમાં વધુ ૨૦ સુધીની નવકારવાળી ગણીશ.
૩. શક્ય હશે ત્યાં સુધી ગુરુ ભગવંતનું વ્યાખ્યાન સાંભળવા
જઈશ.
૪. જીમતાં-જમતાં કે એંઠા મોઢે બોલીશ નહિ. અક્ષરો
લખેલા હોય તેવી વસ્તુ ઉપર ચાલીશ નહિ. ખાઈશ
નહિ, દવા વિગેરે લઈશ નહિ, છાપાં વિગેરેના કાગળો
ઉપર બેસીસ નહિ. બાળીશ નહિ. તેમાં ખાવાનું લઈશ
નહિ. ટોયલેટમાં કાગળનો ઉપયોગ કરીશ નહિ.
૫. જ્ઞાનનાં સાધનો જેવાં કે પેન, પેન્સિલ, ફુટપણી, સાપડો,
કાગળ, પુડાં, સલેટ, બોલપેન વિગેરેને ભાંગીશ-તોડીશ
નહિ. તેનાથી કાન આદિનો મેલ કાઢીશ નહિ. તેનો
છુટો ઘા કરી કોઈને મારીશ નહિ. આવી વસ્તુઓ
ભાણનારાઓને યથાશક્તિ આપીને જ્ઞાનની અને જ્ઞાનીની
સેવા કરીશ.આવી વસ્તુઓની પ્રભાવના કરીશ.
૬. તોતડા-બોબડાની મશકરી-ઠઢો કરીશ નહિ, ધાર્મિક
પુસ્તકોને પસ્તીમાં વેરીશ નહિ. પગ-થુંક લગાડી
આશાતના કરીશ નહિ.
૭. પાઠશાળામાં, ધાર્મિક શિબિરોમાં, પુસ્તકાદિ વસાવવામાં
યથાશક્તિ દ્વારા ખર્ચશિ. ભણાવનાર પંડિતજી, શિક્ષક અથવા
શિક્ષકા બહેનની યથાશક્તિ સાર્થકી ભક્તિ કરીશ.
૮. M.C.ના ટાઇમમાં ધાર્મિક પુસ્તકોનું કે કોઈપણ પુસ્તકોનું
વાંચન નહિ કરું. જ્ઞાનનાં સાધનોનો સ્પર્શ પણ નહિ કરું.

૯. શાસ્ત્રો લખાવવામાં, છપાવવામાં યથાશક્તિ દ્રવ્યનો વ્યય કરીશ. લખનાર-છપાવનારને સહાયક થઈશ.
૧૦. આગમોની પૂજા કરીશ. રૂપ આગમની પૂજા ભણાવીશ. નવા બનતા અને જૂના ચાલતા જ્ઞાનભંડારોમાં સહાયક થઈશ.

ચારિત્રાચાર :-

૧. પાંચ મહાક્રતધારી પૂજય સાધુ-સાધ્વીઓને દરરોજ વંદન કરીશ. (ગુરુ ભગવંત ન હોય તો ફોટાને પણ વંદન કરીશ.) તેમને ગોચરી, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષ્ણ આદિ વહોરાવીશ. તેમની શારીરિક સેવા-ભક્તિ કરવા દ્વારા વૈધાવચ્ચ કરીશ.
૨. વર્ષમાં એક વખત પણ ઉપકારી ગુરુજીનાં દર્શન કરવા તે જ્યાં હશે ત્યાં જઈશ. આશાતના વાળું કાર્ય વર્જ દઈશ. ત્યાગી સાધુ-સાધ્વીઓ મહારાજશ્રી પ્રત્યે ડેયાનું બહુમાન-પ્રેમભાવ રાખીશ.
૩. માત-પિતા આદિ વડિલ વર્ગને પરો લાગીશ. તેમની આશા પાળીશ. તેમનો અવિનય-અવિવેક નહિ કરું.
૪. “સાધુ જીવન દરરોજ યાદ આવે” એટલા માટે ઘરમાં ઓઘો-પાત્રાં વિગેરે સાધુવેશ વસાવીશ. જીવનમાં ચારિત્ર આવે એટલા માટે ઊં હુઁઁ નમો ચારિત્તસ્ય આ પદની ૧ થી ૨૦ સુધીની નવકારવાળી ગણીશ. દીક્ષાં ન લઉં ત્યાં સુધી.....(કોઈપણ એક ચીજ)નો ત્યાગ રાખીશ.

૫. શક્ય બનશે તો સ્વરદ્વયથી ઉપાક્ષય બનાવીશ. અથવા બંધાતામાં સહાયક થઈશ.
૬. અન્ય કોઈ વ્યક્તિ દીક્ષા લેતી હશે તો તેમાં પ્રેરક થઈશ, પરંતુ અંતરાય નહિ કરું. હું પોતે સદાચારી જીવન જીવીશ પરંતુ વ્યસનોવાળું અને વ્યાખ્યારાદિ દોષવાળું જીવન ત્યજ દઈશ.
૭. ધરના સત્યોને (બાળકો આદિને) ધર્મના સંસ્કાર આપીશ. પાઠશાળામાં ભણવા જવાનું, દેરાસરે દર્શન-વંદન-પૂજન કરવાનું, સાધુ-સાધીજીનાં દર્શન-સેવા-ભક્તિ કરવા-કરાવવાનું શ્રીખવાડીશ, સૂત્ર-પાઢાદિ કરાવીશ.

જન સાઇટ

તપાચાર :-  **JAIN SITE** .com

તપાચાર = યથાશક્તિ તપનું આચરણ કરવું.

સંસારના સુખોનો રાગ ઓછો કરવા યથાશક્તિ બાધ્યતાપ અને અભ્યન્તર તપ હું કરીશ. તેમાં જીયેના નિયમો પાણીશ.

૧. દરરોજ ઓછામાં ઓદ્ધંન નવકારશીનું પચ્ચકુખાળ અવશ્ય કરીશ. (જ્યારે શક્ય નહિ જ હોય ત્યારે છેવટે મુક્ષસીનું પચ્ચકુખાળ તો અવશ્ય કરીશ.)
૨. દિવસમાં જમવા સિવાયના સમયમાં ખજ મુક્ષસીનું પચ્ચકુખાળ રાખીશ.

૩. મહિનાની.....તિથિઓમાં ઉપવાસ, આયંગિલ,
એકાસણું અને બેસણું કરીશ.
૪. મારા જીવન દરમ્યાન વર્ષાતિપ, વીશસ્થાનકતપ, સિદ્ધિતપ,
શ્રેણિતપ, વર્ષમાન તપ ઈત્યાદિ યથાશક્તિ કરીશ.
૫. ઉપધાન તપ કરી મોક્ષમાળા પહેરીશ. આ માળા જ્યાં
સુધી ન પહેરાય ત્યાં સુધી.....વિગઈનો ત્યાગ કરીશ.
૬. સંવચ્છરી આદિના દંડુપે નજી ઉપવાસો આદિ પૂરા ન
થાય ત્યાં સુધી.....વિગઈનો ત્યાગ કરીશ.
૭. દર બેસતા મહિને આયંગિલ (.....) કરીશ.
૮. મારા જન્મ દિવસ નિમિત્તે તે દિવસે.....તપ કરીશ.
૯. ગુરુજીની પાસે ભવ આલોચના કરીશ ત્યારબાદ દરવર્ષે
તે તે વર્ષના પાપોની આલોચના લઈશ.
૧૦. પૂર્વે બાંધેલાં કર્મોના કાય નિમિત્તે
યથોચિત.....લોગસ્સનો કાઉસ્સણ કરીશ. (છેવટે
૧૨ લોગસ્સનો કાઉસ્સણ તો અવશ્ય કરીશ ૪.)
૧૧. ગુરુજ આદિ વડીલોનો વિનય કરીશ.
૧૨. ભોજન કરવાના દરેક સમયે ભૂખ કરતાં કંઈક ન્યૂન ૪
ભોજન કરીશ.
૧૩. આખા દિવસમાં.....દ્રવ્યોથી વધારે દ્રવ્યો
વાપરવાની વૃત્તિઓને રોકીશ. (વધારે દ્રવ્યોનો ઉપયોગ
નહિ કરું.)

૧૪. વધારે માદક રસવાળી વસ્તુઓનો ઉપયોગ નહિ કરું.
૧૫. ત્યાગી-તપસ્વી મહાત્મા પુરુષોની વૈયાવચ્ચ કરીશ.
૧૬. દરરોજ.....કલાક સ્વાધ્યાય કરીશ. નવો અભ્યાસ ભાગીશ. જુના અભ્યાસને સંભાળીશ અને અધ્યાત્મ શાસ્ત્રોનું વારંવાર વાંચન કરીશ.
૧૭. શાન્તમસારણા કાર્યમાં યથાશક્તિ સહયોગ આપીશ.
૧૮. જો શક્યતા હશે તો મારા ગામમાં અથવા તીર્થસ્થાનમાં ઉપધાન તપ. કરાવીશ.
૧૯. છ બાબુ અને છ અત્યન્તાર તપમાંથી યથાશક્તિ તપ અવશ્ય કરીશ, મહિનામાં.....એકાસણાં,આંબિલઉપવાસ કરીશ.
૨૦. દરરોજ વારાફરતી ૧ લઘુ વિગઈનો (કાચી અથવા મૂલથી) ત્યાગ કરીશ. મહાવિગઈ (મધ્ય-માસ-મહિરા અને માઘણ) જે ચાર છે તેનો જીવનભર ત્યાગ કરીશ.
૨૧. પેટ ભરીને જમવાને બદલે કંઈક ન્યૂન જમીશ. કોઈપણ એકાદ-બે મિષ્ટાન્નો જીવનભર અથવા દરરોજ (વારાફરતી) ત્યાગ રાખીશ.
૨૨. કરેલી ભૂલની માફી માળીશ. ગુરુજી જે દંડ આપશે તે સ્વીકારીશ વિનય અને વૈયાવચ્ચ કરવાપૂર્વક ધર્મશાસ્ત્રોનો સ્વાધ્યાય કરીશ. સત્સંગ રાખીશ.
૨૩. કર્મકષયના નિમિત્તે, આઠ લોગસ્સનો, જ્ઞાનની આરાધના નિમિત્તે પાંચ લોગસ્સનો ઈત્યાદિ વિવિધ કાઉંસર્ગ કરીશ.

આ તપાચારના છ બાહ્યતપ અને છ અભ્યંતર તપમાં જે જે દોષ લગાડીએ તે તે ૧૨ અતિચાર દોષો જાણવા.

વીર્યાચાર :-

મારા આત્મામાં પ્રગટ થયેલી શારીરિક શક્તિનો (વીર્યનો) ધર્મ કાર્યોમાં ઉપયોગ કરવામાં આળસ-પ્રમાદ કરીશ નહિ. સામાયિકમાં લેવાતાં ખમાસમણાં, બન્ને પ્રતિકમજાની કરતી વિધિ અને ચૈત્યવંદનનાં ખમાસમણાં વિગેરે ઉભા થઈને આપીશ. વિધિપૂર્વક કાર્ય કરીશ. આળસ કરીશ નહિ. દર્શન-વંદન-પૂજન કરવામાં જ્ઞાન ભણવા-ભણાવવામાં, સદાચારનું પાલન કરવામાં મારી છતી શક્તિ ગોપવીશ નહિ. તેના ત્રણે અતિચાર દોષો સેવીશ નહિ.

જ્ઞાન સાઇટ

૧. મન-વચન અને કાયાના બળને ગોપવીશ નહિ.
૨. તીર્થકર પ્રભુના કહ્યા પ્રમાણે સાવધ થઈનેમ ધર્મકાર્યોમાં વીર કોરવીશ.
૩. ધર્યાશક્તિ સદાચારોનું અહણ અને પાલન કરીશ.

સમ્યકૃત્વમાં ન સેવવા જેવા પાંચ દોષો

(૧) શંકા :- તીર્થકર પરમાત્માનાં વચનોમાં કોઈપણ જાતનો સંદેહ કરવો તે શંકા નામનો દોષ. ભજાવા માટે, વધારે સૂક્ષ્મ તત્ત્વ જાગ્રત્વા માટે વિનયપૂર્વક ગુરુજીને પૂછવાની છૂટ. પરંતુ આમ તે કંઈ હોતુ હો ? આ બરાબર નથી. એવા અશ્રદ્ધાના ભાવે શંકા કરવી તે દોષ.

(૨) આકંશા :- તીર્થકર પરમાત્માના શાસન વિના બીજે સ્થળે મેલી વિધા આદિના કારણે અથવા મંત્ર-તંત્રથી કોઈ ચમત્કારો દેખાય, અથવા ઉપર છલ્લુ કંઈપણ સારું દેખાય, તેથી તેમાં અંજાઈ જવું. તે મતની (ધર્મની) ઈચ્છા કરવી તે આકંશા દોષ.

(૩) વિચિકિત્સા : કેન ધર્મનાં અનુષ્ઠાનોના આચરવામાં ફળ મળશે કે નહિ મળે ? એવો મનમાં સંદેહ કરવો તે તથા સાધુ-સાધીજી મહારાજ સાહેબનાં વસ્ત્ર-પાત્ર વગેરે મેલાં હોય, ધૂંક વિગેરેમાં છવોત્પત્તિ ન થાય એટલા માટે કુંડી વિગેરે રાખતા હોય તે દેખોને તેમના ઉપર ઘૃણા (તિરસ્કાર) કરવો તે વિચિકિત્સા દોષ.

(૪) મિથ્યાદસ્થિની ગુણસ્તુતિ : મિથ્યાદસ્થિ આત્માઓમાં ૧. દાન, ૨. વિનય, ૩. વૈયાવચ્ચ, ૪. લોકસેવા, ૫. ત્યાગ-તપ ઈત્યાદિ ગુણો દેખાય તો પણ સભા સમક્ષ કે એવા પ્રકારના જાહેર સ્થાનોમાં તે ગુણોની પ્રશંસા કરવી તે

ચોથો મિથ્યાદસ્તિની ગુણસ્તુતિ નામનો દોષ. તેમ કરવાથી તેના પક્ષને ટેકો મળે. તે જીવ મિથ્યાત્વમાં વધારે દૃઢ થાય.

(૫) મિથ્યાદસ્તિનો પરિચય : અન્ય ધર્મઓના પાડોશમાં વસ્તું, તેઓનો વધારે પરિચય કરવો, તેઓની સાથે મિત્રતા કરવી, તેઓની સાથે બેસ્તું, ઉઠ્ઠું, વિગેરે મિથ્યાદસ્તિ પરિચય નામનો પાંચમો દોષ. આવો દોષ સેવવાથી આવેલું સમ્યકૃત ચાલ્યું જાય.

આ પાંચ દોષો ત્યજી દેવા. સેવવા નહિ. અને નીચે લખેલાં પાંચ લક્ષણો (પાંચ ગુણો) અવશ્ય આદરવા.

સમ્યકૃત્વના જોપાંચતાગુણો

૧. કોષ અને માનાહિના ગમે તેવા પ્રસંગો આવે તો પક્ષ તેને દ્વારીને સમતાભાવ (સ્થિરતાભાવ) રાખવો તે પ્રશામગુણ.

(૨) મોક્ષમાં દુઃખ વિનાનું, આત્માના ગુણોની રમણતાનું સહજ સુખ છે. એમ સમજી તેની અતિશય ઈચ્છા કરવી તે સંવેગગુણ.

(૩) સંસાર એ દુઃખોની ખાણ જ છે. એમ સમજી તેમાંથી નીકળવાની તીવ્ર ઈચ્છાપૂર્વક બંધનોથી અને કષાયોથી ભરેલાં એવાં સંસારનાં સુખો ઉપર તિરસ્કારનો ભાવ, કંટાળો, ઉદ્વેગ, ક્યારે છૂટું તેવી ઈચ્છા તે નિર્વેદગુણ.

(૪) દુઃખી, દીન, દરિદ્રી અને રોગપીડિત આદિ જીવો પ્રત્યે તેનાં દુઃખો દૂર કરવાની ઈચ્છા કરવી અને તે

દુઃખો દૂર કરવા યથાશક્તિ પ્રયત્નો કરવા તે દ્વયદયા અને ધર્મ ન પામેલા છ્વા પ્રત્યે ધર્મ પમાડવાની ઈચ્છા કરવી અને તેવા પ્રયત્નો કરવા તે ભાવદયા, એમ દ્વયદયા તથા ભાવદયા એ અનુકૂળગુણ.

(૫) સર્વજ્ઞ કેવલી અને વીતરાગ એવા તીર્થકર પરમાત્માએ જે કંઈ શાસ્ત્રોમાં કહ્યું છે તે સંપૂર્ણ સત્ય જ છે. એવો દઢ નિશ્ચય. અત્યારે વિશ્વાસ તે આસ્તિકતા ગુણ.

આ પાંચ ગુણો (લક્ષણો) યથાશક્તિ પાળવાં.



स्थूल प्राणातिपात विरमण प्रत

स्थूल = भोटी-भोटी, प्राणातिपात = हिंसानो,
विरमण = त्याग अेवुं, व्रत = नियम.

કोઈपणा ज्ञातना अनिवार्य प्रयोजन विना निरपराधी
अेवा छालता चालता (ऋस) छवोने महारे, जाडी बूँडीने
भारवा नहि, छालवा नहि, आवो जे छवनभरनो नियम ते
पहेलुं प्रत कहेवाय छे.

घर बंधाववुं, पायो खोदाववो, जेती करता कोईअे
तो जेतर जेडुं, इत्याहि अनिवार्य कार्य करवामां थती हिंसानी
ज्यष्ठा (छुट)

कोई नोकरे, घरना कोई सल्पे के हुकाननी कोई
व्यक्तिअे योटी करी होय विगेरे अपराध (गुनो) कर्हो होय
तो तेवा दोषथी तेने बचाववा माटे कपको आपवो पडे अथवा
अल्प ताडन करवुं पडे तेनी ज्यष्ठा.

संसारनु रोछंदु कार्य करवामां पृथ्वीकाय-अपूर्कय विगेरे
पांच मकारना स्थावर छवो हुकाई जाय छे तेनी ज्यष्ठा.
इतां शक्य होय तेटली हिंसामां अल्पता करवी.

आ प्रत पाणवामां नीयेना नियमो ध्यानमां राखवा.
जे पाणी शक्य त्यां निशानी करवी. न ज पाणी शक्य
त्यां योकडी करवी.

१. पशु-पक्षी-मनुष्यनी हत्या (भून) करीश नहि, तेओने
चम्पु, लाकडी, पत्थर, वेलाण आदिथी भारीश नहि,
नोकर-चाकरने पङ्गा भारीश नहि.

जैन साइट

૨. ગર્ભપાત કરીશ નહિ-કરાવીશ નહિ, કરતાને સારા માનીશ નહિ.
૩. કીડી-મંકોડા-ઉદર કે સર્પના દર (માટીમાં ઉડા પોલાણ)ને પુરીશ નહિ. તેમાં ગરમ પાણી-તેલ વિગેરે નાખીશ નહિ.
૪. પશુ-પંખીને પાળીશ નહિ. પરસ્પર લડાવીશ નહિ. પાંજરામાં પૂરીશ નહિ. કાચમાં માછલી ઘર બનાવીશ નહિ.
૫. નોકર-ચાકરને તથા આપણા આશ્રયે જીવનારાને ભૂષ્યા-તરસ્યા રાખીશ નહિ. તેઓ પાસે નિયત કરેલા કોમથી વધારે કામ (વેતન-પગાર આપ્યા વિના) કરાવીશ નહિ.
૬. મંદ્યર, માંકડ, માઝી, જૂ, ઉદર, કીડી, મંકોડા, વાંદા વિગેરે જીવોના ઉપદ્રવો દૂર કરવા ડી.ડી.ટી. છંટાવીશ નહિ, તેઓની હિંસા કરીશ નહિ. આવા જીવોની ઉત્પત્તિ જ ન થાય તે માટે ઘર સ્વચ્છ જ રાખીશ.
૭. અનાજ સાફ કરતાં, શાકભાજ સમારતાં, ઘર દુકાન ફેક્ટરી આદિની સફાઈ કરતાં ત્રસજીવો ન મરે તેની પૂરતી કાળજ રાખીશ.
૮. જોયા વિના અને વીણ્યા વિના અનાજ દળાવીશ નહિ, ગેસ-ચૂલા જોયા-પુંજ્યા વિના સળગાવીશ નહિ, ઝડપાન કાપીશ નહિ અને કપાવીશ નહિ. વનસ્પતિ ઉપર ચાલીશ નહિ.
૯. રસોડમાં પુંજ્યાનો ઉપયોગ કરીશ અને ઘરમાં કોમળ સાવરણીનો ઉપયોગ કરીશ. કંપાઉન્ડમાં લોન ઉગાડીશ નહિ. પરમાત્માની પૂજા આદિ ઉત્તમ કાર્ય વિના ફૂલ તોડીશ નહિ અને પૂજા માટે પણ વિવેક અને જ્યથાપૂર્વક ફૂલ લાવીશ. ફૂલની વેળીનો ઉપયોગ કરીશ નહિ.

૧૦. ક્રીઝનું, બરફવાળું અને અળગણ પાછી વાપરીશ નહિ. અળગણ પાછીથી સ્નાન કરીશ નહિ. ફૂવારાથી સ્નાન કરીશ નહિ. તોલમાં પરિમિત પાછી લઈને સ્નાન કરીશ. પાછી પીને એંધો જ્લાસ માટલામાં નાખીશ નહિ. જ્લાસ કપડાથી લુંછીશ.
૧૧. નદી-તળાવ-ફૂવા-સરોવર અને સમુદ્ર જેવા અતિશય પાછી (બહોળા પાછી)વાળા સ્થાનોમાં સ્નાન કરીશ નહિ. તેમાં કપડાં ધોઈશ નહિ. પરંતુ પરિમિત અને ગળેલા પાછીથી કપડાં ધોઈશ અને ધોવડાવીશ. પાંચ તિથિએ અને પર્વતિથિએ કપડાં ધોઈશ નહિ.
૧૨. ભોજન-પાછીનાં, દૂધ-દહી-ધી-તેલનાં વાસણો ઉધાડાં રાખીશ નહિ. એક થાળીમાં કોઈની સાથે જમીશ નહિ. એહું મૂકીશ નહિ અને થાળી ધોઈને પી જઈશ.
૧૩. શક્ય હશે તો દરરોજ અથવા ૫/૧૦/૧૨ તિથિએ અથવા પર્યુષણ, ઓળી જેવા પર્વદિવસોમાં અને તીર્થ સ્થાનોમાં ઉકળેલું પાછી પીઈશ.
૧૪. જરૂરિયાત વિના પાછીના નળ ખુલ્લા રાખીશ નહિ. અપ્સ્કાયની ડિસા થાય છે એમ સમજ ધીની જેમ તેનો ઉપયોગ કરીશ. પાછી ઉપર કે લીલહુલ ઉપર ચાલીશ નહિ. શક્ય બનશે તો જંગલમાં (ખુલ્લી જગ્યામાં) ટોયલેટ કરીશ.
૧૫. ઘરમાં ઠંડીથી બચવા તાપણું કે હીટરનો ઉપયોગ કરીશ નહિ. (પરંતુ ઠંડીને રોકવા વધારે કપડાં પહેરીશ અને ઓઢીશ) તથા ગરમીથી બચવા પંખો કે એરક્ષનીશન વાપરીશ નહિ.

૧૬. ઉક્તાં-બેસતાં અને ચોલતાં નીચે જોઈને જીવહિસા ન થાય તેમ કાર્યો કરીશ. બોલતાં વાઉકાયની હિસા ન થાય માટે મુખ ઉપર મુહૃપત્તિ અથવા રૂમાલ રાખીશ.

ઉપર મુજબના યથાશક્તિ નિયમ પાળીશ તથા નીચેના પાંચ અતિચારો (દોષો) લગાડીશ નહિ. બઢુ જ વિવેકવાળું જીવન જીવીશ.

ન સેવવા જેવા પ્રથમ વ્રતના પાંચ અતિચારો (દોષો)

૧. વધ : કોઈપણ જીવને હણવો-મારવી.
૨. બંધ : સાંકળ, દોરી અને પાંજરા આદિથી કોઈપણ જીવને બંધનમાં રાખવો.
૩. છવિચુદેશ : કાન-નાક વિધવાં, ચામડીનો છેદ કરવો, દામ દેવા વિગેરે.
૪. અતિભારારોપણ : બળદ, પાડા, ઊંટ વિગેરે પશુઓ અને મજૂરી કરતા મનુષ્યો સુખે-સુખે જેટલું ઉચ્ચકી શકે તેનાથી વધારે ભાર તેના ઉપર મૂકવો. બુદ્ધિજીવી માણસો પાસે નિયત કરેલા કામથી વધારે કામ લેવું.
૫. અકંતપાનવ્યુચ્છેદ : નોકર-ચાકર અથવા આપણા આંત્રિક જીવોને ભોજન-પાણીનો વિરહ કરવો. સમયસર ભોજન ન આપવું.

આવા પ્રકારના પાંચ અતિચારો (દોષો) વિના અને ઉપરોક્ત ૧૬ નિયમો યથાશક્તિ પાળવાપૂર્વક સ્થૂલ ગ્રાણતિપાત વિરમણ નામનું પહેલું ક્રત હું પાળીશ.

૨. સ્થૂલ મૃષાવાદ વિરમણ પ્રત

સ્થૂલ=મોટુ-મોટુ, મૃષાવાદ=જૂહુ બોલવાનો,
વિરમણ=ત્યાગ એવું ક્રત=નિયમ.

જે જૂહું બોલવાથી હું જૂહાબોલો કહેવાઉં, લોકો વિશ્વાસ
ન કરે, ઈજ્જત-આબરું નાશ પામે, ફોજદારી ચુન્દો લાગુ પે
એવું (મોટું) જૂહું હું બોલીશ નહિ. આ બીજું સ્થૂલ મૃષાવાદ
વિરમણ પ્રત કહેવાય છે.

ધંધાકીય સામાન્ય જૂહુ, આનંદ-પ્રમોદમાં સામાન્ય જૂહુ
લેવડ-દેવડમાં, માયા-કપટાદિ દોષોની અપેક્ષા વિના વ્યવહારથી
નિર્દોષ લાગતું એવું જૂહુ બોલાઈ જાય તો તેની જયશ્વા. આ
પ્રત પાળવામાં નીચેના નિયમો પથાશક્તિ અવશ્ય પાળવા. જે
પાળી શકાય તેમ હોય ત્યાં નિયમનેનાની પાળી શકાય તેમ
હોય ત્યાં આવી નિશાની કરવી.

૧. ઘર-જમીન, દુકાન, સ્થાવર મિલકત, સોનુ, રૂપુ, હીરા
આદિ ઝવેરાત, સંબંધી લેવડ-દેવડ અને સંબ્રહ આદિમાં
જૂહું બોલીશ નહિ.
૨. વકીલાતનો ધંધો કરીશ નહિ. કોર્ટોમાં ખોટી સાક્ષી
ભરીશ નહિ. દસ્તાવેજ આદિ ખોટા કાગળો લખીશ
નહિ. કોઈને ખોટી શિખામણ આપીશ નહિ. ખોટા
લેખ લખીશ નહિ. ખોટા કેસ કરીશ નહિ.
૩. લગ્ન જોડવામાં ઉમર-અભ્યાસ આદિ સંબંધી જૂહું બોલીશ
નહિ. કોઈનો પણ વિશ્વાસધાત કરીશ નહિ. કોઈએ મહારે
ત્યાં જમા મૂકેલી 'થાપણ ઓળવીશ નહિ.

૪. કોઈના પણ ઉપર ખોટા આક્ષેપો-કલંકો આપીશ નહિ. કોઈને પણ ગાળો કે અસત્ય વચનો બોલીશ નહિ.
૫. પશુ-પક્ષી સંબંધી લે-વેચમાં જૂહું બોલીશ નહિ. કોઈએ વિશાસથી મને કહેલી ગુપ્તવાત બહાર પ્રકાશિત કરીશ નહિ. આવેશમાં આવીને કોઈને પણ દુઃખ થાય તેવું બોલીશ નહિ.

ઉપરોક્ત નિયમો યથાશક્તિ સાચવીને હું બીજું ગ્રત પાળીશ. તેમાં નીચેના પાંચ અતિચારો (દોષો) લગાડીશ નહિ.

ન સેવવા યોગ્ય બીજા ગ્રતના પાંચ અતિચારો

૧. મિથ્યોપદેશ : ખોટો ઉપદેશ, ખોટી શિખામણા આપવી તે.
૨. રહસ્યાભ્યાખાન : કોઈ વ્યક્તિએ એકાન્તમાં કહેલી વાત પ્રસિદ્ધ કરવી તે.
૩. ફૂટલેખ કિયા : ખોટા લેખ, દસ્તાવેજ અને કાગળો લખવા તે.
૪. ન્યાસાપહાર : કોઈએ જમા મૂકેલી થાપણ પચાવી પાડવી તે.
૫. સાકારમન્ત્રભેદ : બીજાની ગુપ્તવાત તેના આકાર (ધાવભાવ)થી જાણીને પ્રસિદ્ધ કરવી તે. પતિ-પત્ની વચ્ચેની ગુપ્ત વાતો પ્રગટ કરવી તે.

આ પાંચ દોષો લગાડીશ નહિ એવું બીજું ગ્રત હું પાળીશ.

૩. સ્થૂલ અદત્તાદાન વિરમણ પ્રત

સ્થૂલ = મોટી, અદત્તાદાન = ચોરી, આખ્યા વિનાનું લેવું, વિરમણ = ત્યાગ, બ્રત = નિયમ.

બીજાની માલિકીની કોઈપણ વસ્તુ તે તે માલિકે આખ્યા વિના તેની સમ્મતિ વિના (જેનાથી હું ચોર કહેવાઉં એવી) ફોજદારી ગુંઢાને યોગ્ય વસ્તુ લઈશ નહિ. અર્થાતું ચોર કહેવાઉં, મારી ઈજજત હલકી ધાર્યા, ફોજદારી ગુંઢો લાગુ પડે એવી મોટી ચોરી કરીશ નહિ. જ્યાંસારા સંબંધ હોય ત્યાં પેન કાગળ જેવી નાની વસ્તુ અને આડોશ-પાડોશના સંબંધો સારા હોય ત્યારે પાડોશીનાં વાસણાધર જેવી વસ્તુઓ પ્રસંગ પૂરતી પૂછ્યા વિના પણ (જ્યાં ચોરીની બુદ્ધિ નથી ત્યાં) વાપરવાની જરૂરા.

આ પ્રતમાં નીચેના નિયમો યથાશક્તિ પાળવા જોઈએ.
જે પાળી શકાય તેમ હોય અને પાળવાની ઈચ્છા હોય ત્યાં
 નિશાની કરવી. અને જે પાળી શકાય તેમ ન હોય ત્યાં
 આવી નિશાની કરવી.

- હું ધન-ધાન્ય સોનુ-રૂપુ દાગીના તથા જમીન આદિની ચોરી કરીશ નહિ. કોઈની પણ વસ્તુ સમ્મતિ વિના લઈશ નહિ. . .
- ચોરીનો માલ લઈશ નહીં. અને તેવા માલની લે-વેચ કરીશ નહિ.

૩. હું કોઈના પણ ધરમાં તેનાં તાણાં તોડવાં, તિજોરી તોડવી-ખોલવી, કોઈપણ વસ્તુઓ ઉઠાવવી આવા ચોરીનાં કામો કરીશ નહિ.
૪. ખોટાં તોલ-માપ રાખીશ નહિ. માલ લેવા માટે તોલમાપ અધિક વજનનાં અને માલ આપવા માટેનાં તોલમાપ ઓછા વજનનાં એમ ખોટું કરીશ નહિ.
૫. કોઈપણ માલમાં ભેળસેળ કરીશ નહિ. સારો માલ દેખાડી ખોટો માલ આપીશ નહિ તથા ઉપર સારો અને નીચે (અંદર) ખોટો માલ એમ મિશ્ર કરીને આપીશ નહિ.
૬. હું કોઈની જમા થાપણની ચોરી કરીશ નહિ તથા દાણચોરી કરીશ નહિ. રાજ્યના કાયદાઓનું ઉલ્લંઘન કરીશ નહિ.
૭. હું પોતે લાંચ-રુશત લઈશ નહિ તથા શક્ય હશે ત્યાં સુધી લાંચ આપીશ પણ નહિ.
૮. રસ્તામાં પડેલી વસ્તુ પણ લઈશ નહિ.
૯. ટિકીટ વિના ટ્રેન-બસ વિગેરેની મુસાફરી કરીશ નહિ.
૧૦. પેન-પેનિસલ, રબર, ફુટપણી, કંપાસ, નોટબુક, ચંપલ, સ્લીપર, સેંડલ કે ટોપી જેવી સામાન્ય વસ્તુઓ પણ માલિકની સભ્મતિ વિના લઈશ નહિ. અને સાથે બજાતા કે ફરતા હોઈએ તેવા માણસોની પણ કોઈ વસ્તુ પ્રયોજનવશ લઉં તો પણ ચોરીની બુલ્દિપૂર્વક લઈશ નહિ.
૧૧. સરકારી ખાતાની ટેક્સ વિગેરેની ચોરી કરીશ નહિ.

જૈન સાઇટ

જૈનમ् જ્યતિ શાસનમ्

ત્રીજા પ્રતના ઉપરોક્ત નિયમો હું પાળીશ. તથા હવે કહેવાતા પાંચ અતિચારો (દોષો) સેવીશ નહિ. તે પાંચ દોષો (અતિચારો) આ પ્રમાણે છે.

ન સેવવા યોગ્ય ત્રીજા પ્રતના અતિચારો

1. સ્તેનપ્રયોગ = ચોરને ચોરીનું કાર્ય કરવામાં સહાયક થવું, મદદ કરવી તે.
2. તદાહૃતાદાન = ચોરે લાવેલો ચોરીનો ભાલ લેવો તે.
3. વિરુદ્ધરાજ્યાતિક્રમ = રાજ્યના કાયદાનું ઉલ્લંઘન કરવું તે.
4. હીનાધિકમાનોન્માન = દેવા-લેવાનાં તોલ-માપ જુદાં જુદાં રાખવાં તે.
5. પ્રતિરૂપકબ્યવહાર = સારા-ખોટા ભાલની ભેગસેળ કરવી તે.

ઉપરોક્ત પાંચ દોષો લગાડીશ નહિ એવું ત્રીજું પ્રત પાળીશ.

૪. સ્વદારાસંતોષ પ્રત (પરદારા વિરમણ પ્રત)

સ્વ = પોતાની, દારા=સ્ત્રી (સ્ત્રીને આશ્રયી પુરુષ)માં જ, સંતોષ=તૃપ્તિ માનવી, ઘર=બીજાની, દારા=પત્નીની સાથેનો અવહાર, વિરમણ=ત્યાગ.

હું જીવનભર મારી પોતાની પત્નીની સાથેના જ સંસારબ્યવહારમાં સંતોષ માનીશ. (અને સ્ત્રીને આશ્રયી સ્વપુરુષમાં જ સંતોષ માનીશ) પરની પત્ની સાથે, કુમારિકા સાથે, અધ્યવા વેશયા આદિ સાથે સંસારબ્યવહાર કરીશ નહીં. આવા પ્રકારનું આ ચોથું પ્રત હું પાળીશ.

(પરદારાવિરમણપ્રત અતિશય ઓળખી રાજી-મહારાજાઓ અને કામાસકત જીવો માટે જ હોય છે. માટે તેની ચર્ચા અહીં કરી નથી.) આ પ્રત લીધા પછી હું નીચેના નિયમો પાળીશ. પણાય તેમાં અને ન પણાય તેમાં કરીને પ્રતનું પચ્ચક્ખાણ લેવું.

1. હું કોઈ પણ સ્ત્રીનાં / પુરુષનાં અંગો અને ઉપાંગો કામ વિકારની બુદ્ધિપૂર્વક જોઈશ નહિ.
2. ઉદ્ભબ વેશ પહેરીશ નહિ. જે વેશથી શરીરનાં અંગો દેખાય અને જોનારને વિકાર-વાસના થાય તેવાં અર્ધનારીવસ્થાવાળાં અથવા અલ્ય વસ્ત્ર પહેરીશ નહિ.
3. દિવસે બ્રહ્મચર્ય પાળીશ (મૈથુન કીડા કરીશ નહિ.)
4. હું ભાિનામાં ૫-૧૦-૧૨ તિથિઓ બ્રહ્મચર્ય પાળીશ.

૫. સર્વથા ભ્રષ્ટચર્ય પ્રતિ પાળવાનો નિયમ ન લઈ શકાય ત્યાં સુધી.....નો ઉપયોગ કરીશ નહિ.
૬. તીર્થસ્થાનોમાં, પર્યુષણ પર્વ તથા નવપદની ઓળી જેવા પર્વના દિવસોમાં ભ્રષ્ટચર્ય પાળીશ.
૭. તિર્યંચોની સાથે મૈથુન સેવીશ નહિ તથા પુરુષ-પુરુષની સાથે કે સ્ત્રી-સ્ત્રીની સાથે હસ્તમૈથુન અથવા અત્યંત વિકારવાનું આદિંગન આદિ કામકીડા કરીશ નહિ.
૮. કુમારિકા કે વેશયા આદિ સ્ત્રીઓ (જો કે પરની માલિકીની સ્ત્રી નથી તો પણ તેઓ)ની સાથે સંસારવ્યવહાર કરીશ નહિ.
૯. પોતાની પત્નીમાં / પુરુષમાં પણ અત્યંત કામાસક્ત બનીશ નહિ.
૧૦. કામવાસના ઉત્તેજક ટેબ્લેટ, કેપ્સ્યુલ વિગેરે દવાઓ અથવા એવી કોઈ ઔષધિઓ લઈશ નહિ.
૧૧. હું સ્ત્રીમિત્ર (ગર્લફેન્ડ)/પુરુષમિત્ર (બોયફેન્ડ) રાખીશ નહિ.
૧૨. મનમાં વિકારો પેદા થાય તેવી કામોતેજક વાર્તાઓ, બિલબત્સ શબ્દપ્રયોગ, ચલચિત્રો જોવાનું કે તેવી સેક્સની કથાઓ વાંચવાનું કે વંચાવવાનું કામ કરીશ નહિ.
૧૩. બલ્યુ ફિલ્મ જોવાનું, જોવડાવવાનું કે તેના પ્રોત્સાહનનું કાર્ય કરીશ નહિ.
૧૪. સ્ત્રી-પુરુષના સૌન્દર્યની, ઝપની, ટાપ્ટીપની, વેષભૂષાની, અલંકારોની (કામોતેજક) વાતો કરીશ નહિ. બહુ ટીકી-ટીકીને જોઈશ નહિ.

१५. ज्वालादारी विनानां लग्नो के संगपडो करीश नहि, कुरावीश नहि, तेमां भाग लर्हश नहि. पति-पत्नीना जोड़कानी अतिशय प्रशंसा करीश नहि.
१६. कामविकारनी बुद्धिए परस्त्रीनो / परपुरुषनो स्पर्श करीश नहि.
१७. ब्रह्मर्यना पालन माटे “ॐ ह्लौं नमो बंभवयधारीणं” आ पहनी माणा गणीश तथा नेमनाथ प्रेमुना चरित्रनु अने श्री स्थूलिभद्रज्ञनु सतत स्मरण-मनन-चिंतन तथा आराधना करीश. तेना द्वारा कामवासनाने छतीश.
१८. जे आसनाहि उपर परस्त्री जेठी होय (अथवा परपुरुष जेठो होय) ते आसन उपर साथे बेसीश नहि.
१९. हुं परस्त्रीनी साथे स्वस्त्रीनी निंदानु के अकुशणतानु वर्षन करवानुं काम नहि करु. (के जेथी मारा तरक परस्त्री आकर्षय नहि.)
२०. जेड्डममां स्त्रीनां, अर्धनरन स्त्रीनां के कामोत्तेजक चित्रो राखीश नहि. दिवाले चोटाईश नहि, तथा गुप्त अंगो देखाय तेवां चित्रो राखीश नहि. (स्त्रीने आश्रयी पुरुषनां चित्रो)
२१. जे आसन उपर स्त्री जेठी होय ते स्थाने स्त्री उठी गया पछी पुरुष बे घडी सुधी बेसे नहि अने जे आसन उपर पुरुष जेठो होय ते आसन उपर पुरुष उठी गया पछी स्त्री नरा प्रहर (ए क्लाक) सुधी बेसे नहि.

ઉપરોક્ત નિયમો પાળવાપૂર્વક હું સ્વદારાસંતોષ નામનું આ ચોથું પ્રત પાળીશ. તેમાં નીચેના પાંચ અતિચારો (દોષો) લગાડીશ નહિ.

ન સેવવા ધોષ્ય ચોથા પ્રતના અતિચારો

1. પરવિવાહકરણ = જવાબદારી વિનાનાં પારકાનાં લગ્નો કરાવવાં, અર્ધ લગ્નો (સગપણ) કરાવવાં.
2. ઇત્વરપરિગૃહીતાગમન = અલ્યકાળ માટે પર વડે રખાત રખાયેલી સ્ત્રીની સાથે (પરની સાથે વિવાહિત થયેલી આ પત્ની નથી એમ માનીને) મૈથુન સેવન કરવું તે. (સ્વદારાસંતોષીને આ દોષ સેવાય નહિ. આ દોષ જો સેવે તો તે અનાચાર બને છે.)
3. અપરિગૃહીતાગમન = ન પરણેલી અર્થાત् કુમારિકા સાથે અથવા વેશ્યાની સાથે વિષયસેવન કરવું તે. (આ પણ દોષ સ્વદારાસંતોષીને માટે ઉચિત નથી. અનાચારરૂપ થાય છે.)
4. અનંગક્રીડા = જે અંગો કામકીડાનાં નથી. તે અંગોથી કામકીડા કરવી તે.
5. તીવ્રકામાભિનિવેશ = કામવાસનાની અત્યન્ત તીવ્ર આસક્તિ રાખવી

ઉપરોક્ત અતિચારો (દોષો) લગાડ્યા વિના હું સ્વદારાસંતોષ નામનું આ ચોથું પ્રત પાળીશ.

૪. પરિગ્રહ પરિમાણ વ્રત

પરિગ્રહ = ધન-ધાન્યાદિ પદાર્�ો તથા મૂર્છા - ભમતા,
પરિમાણ = માપ ધારવું.

હું નીચે મુજબ ધન-ધાન્ય, સોનુ-રૂપુ વિગેરે વસ્તુઓ
 તથા મિલકત વિગેરે વસ્તુઓ ધારેલા માપથી વધારે રાખીશ નહિ.

૧. ધન = રોકડ નાણું શેરો, ફીક્સ ડીપોઝીટો વિગેરે
 સર્વેમાં મળીને ધન વધારેમાં વધારે.....થી
 વધારે રાખીશ નહિ. ખરીદ લાવે આ માપ
 હું ધારું છું.

૨. ધાન્ય = ઘઉં, બાજરી, મકાઈ, ચોખા, મગ વિગેરે સર્વ
 ધાન્યો મળીને હું વધારેમાં વધારે ઘરમાં.....
 ક્રીલોથી અને દુકાનમાં.....ક્રીલોથી વધારે
 રાખીશ નહિ.

૩. કોત્ર = ખુલ્લા પ્લોટો-જમીન અને ખેતર વિગેરે.....
 કુટથી કે મીટરથી વધારે રાખીશ નહિ.

૪. વાસ્તુ = વસવાટ કરી શકાય તેવાં બાંધેલા મકાનો
 બંગલા-હવેલીઓ-દુકાનો-ઓફિસો વધુમાં વધુ
થી વધારે રાખીશ નહિ.

૫. રૂપ્ય = ચાંદીના દાગીના અથવા ચાંદી.....ગ્રામથી
 વધારે રાખીશ નહિ.

૬. સુવર્ણ = સોનુ અથવા તેના દાગીના.....ગ્રામથી
વધારે રાખીશ નહિ. તથા હીરા-માણોક-મોતી
વગેરે બાકીનું જીવેરાત.....રકમથી વધારે
રાખીશ નહિ.

૭. કુચ = ઘરની ઘર-વખરી રાચરચીલું અને ફરનીચિર
વિગેરે સર્વે મળીને.....રકમની કિમતથી
વધારે રાખીશ નહિ.

૮. દ્વિપદ = ઘરમાં.....અને દુકાનમાં.....થી
વધારે નોકર-ચાકર રાખીશ નહિ.

૯. ચતુર્ધદ = ગાય-બેશ-બળદ-ઓંટ-બડકરી વિગેરે ચારપગાં
(ચાર પગવાળાં) માણીઓ.....થી
વધારે રાખીશ નહિ.

આવા મકારનું પાંચમું ક્રતાં હું માણીશ. તેમાં નીચેના
નિયમો પણ યથાશક્તિ પાળીશ. જે પાળી શકાય તેમ હોય
ત્યાં અને ન પાળી શકાય તેમ હોય ત્યાં આવી
નિશાની કરવી.

૧. ધારેલી મિલકત કરતાં વધારે આવક થાય તો સ્ત્રી-
પુત્રાદિના નામે ફેરબદલી કરવા દારા મારી મમતાને
પોષીશ નહિ. પરંતુ ધર્મમાર્ગ જર્ચરી નાખીશ.
૨. કોઈપણ એક પરિગ્રહની ધારેલી રકમ બીજા પરિગ્રહમાં
ઉમેરીશ નહિ.
૩. બાવોની વધઘટે (હૈયામાં માયા રાખીને) ફેરફાર કરીશ
નહિ.

૪. સ્કુટર, મોટર વિગેરે સાધનોની કિમત પણ ધનના પરિશ્રમાં ગણીશ.
૫. બાપદાદાની વારસાગત મળતી મિલકત માટે કે ધરાકો પાસે લેવાની નીકળતી રકમ માટે કોર્ટનો આશ્રય લઈશ નહિ. શ્રાવકપણાને અનુચ્છિત કલેશ-કંકાસ કરીશ નહિ.

ઉપરોક્ત નિયમો પાળવાપૂર્વક હું આ પ્રત પાળીશ. તથા તે પ્રતના નીચે મુજબ પાંચ અતિચારો સેવીશ નહિ.

ન સેવવા યોગ્ય પાંચમા પ્રતના અતિચારો

૧. ધનધાન્યપ્રમાણાતિક્રમ = ધૂન અને ધાન્યના ધારેલા માપનું ઉલ્લંઘન કરવું તે.
૨. ક્ષેત્રવાસ્તુપ્રમાણાતિક્રમ = ખુલ્લી જમીન અને બાંધેલા મકાનોના ધારેલા નિયમોનું ઉલ્લંઘન કરવું તે.
૩. હિરણ્યસુવર્ણપ્રમાણાતિક્રમ = ઝવેરતના ધારેલા માપનું ઉલ્લંઘન કરવું તે.
૪. દાસીદાસપ્રમાણાતિક્રમ = નોકર-ચાકર, સ્ત્રી-પુરુષ તથા પશુના માપનું ઉલ્લંઘન કરવું તે.
૫. કૃષ્ણપ્રમાણાતિક્રમ = ફરનીચર તથા રાચરચીલાના માપનું ઉલ્લંઘન કરવું તે.

ઉપરોક્ત પાંચ અતિચારો વિના હું આ પાંચમું પ્રત પાળીશ.



૬. દિગ્પરિમાણ વ્રત

(પ્રથમ ગુણવ્રત)

દિગ્=દિશાનું, પરિમાણ=માપ ધારવું તે. વ્રત=નિયમ.

મારા નિવાસસ્થાનથી ચારે દિશાઓમાં, ચારે વિદિશાઓમાં ઉપર અને નીચે એમ કુલ દસે દિશાઓમાં.....
માઈલથી (અથવા કીલોમીટરથી) વધારે દૂર જઈશ નહિ. તેમાં
યથાશક્તિ નીચેના નિયમો પાળીશ. શક્ય હોય ત્યાં ✅ અને
શક્ય ન હોય ત્યાં ✖ નિશાની કરવી.

૧. એક દિશાનું માપ (ન જવાનું હોય એટલે) બીજા દિશામાં (જ્યાં જવાનું બન્યું છે ત્યાં) ઉમેરીશ નહીં.
૨. અમેરિકા-આફિકા-ઇંગ્લેન્ડ, જર્મન અને ગ્રાપાન જેવા દેશોમાં જઈશ નહિ. (ભારત બહાર જઈશ નહિ) અથવા જવું જ પડે તો તે તે દેશોમાંવારથી વધારે વાર જઈશ નહિ. વિદેશોમાં જ વસતા ભાઈ-બહેનોએ પડા પોતાના નિવાસવાળા દેશ વિના બીજા દેશોમાં જવા-આવવાની ઉપર મુજબ ધારણા કરવી.
૩. જીવનમાં.....થી વધારે વાર ખેનમાં મુસાફરી કરીશ નહિ.
૪. જીવનમાં.....થી વધારે વાર સ્ટીમ્બર, લોંચ,
છોડી અને વહાણ દ્વારા દરિયાઈ મુસાફરી કરીશ નહિ.
૫. હું ચોમાસામાં તીર્થયાત્રા વિના.....થી વધારે વાર
બહારગામ જઈશ નહિ.
૬. ચોમાસામાં ભારતમાં જ રહીશ. (અથવા મારા

વસવાટવાળા દેશમાં જ. રહીશ.) અને ભારતમાં પણ રાજ્યસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, તામિલ, કર્ણાટક, આન્ધ્ર આદિ પ્રાન્તીય દેશોમાં પણ.....થી વધારે વાર જઈશ નહિ.

૭. ખાસ અનિવાર્ય કારણ વિના રાત્રે ૧૧-૧૨ વાગ્યા પછી ઘર બહાર જઈશ નહિ.
૮. પર્યુષણ જેવા મહાપર્વના દિવસોમાં વિશિષ્ટ કારણ વિના ગામ બહાર જઈશ નહિ.
૯. ધર્મનાં કાર્યો માટે અથવા જૈન શાસનની પ્રભાવના અર્થ ધારેલા દિશાના નિયમથી અધિક જવું પડે તો તેની જ્યષ્ઠા. છદ્રા વ્રતના ઉપરના નિયમો હું ધથાશક્તિ પાળીશ. તથા નીચેના અતિચારો લગાડીશ નહિ.

ન સેવવા યોગ્ય છદ્રા વ્રતના અતિચારો

- નિયમ જ્યાંત શાસનમાં
૧. ઉર્ધ્વદિશાવ્યતિક્રમ = ઉપરની દિશામાં ધારેલા માપથી અધિક જવું તે.
 ૨. અધોદિશાવ્યતિક્રમ = નીચેની દિશામાં ધારેલા માપથી અધિક જવું તે.
 ૩. તિર્યક્રિદશાવ્યતિક્રમ = ચારે દિશા-વિદિશામાં ધારેલા માપથી અધિક જવું તે.
 ૪. ક્ષેત્રબૃદ્ધિ = એક દિશાનું માપ બીજી દિશામાં ઉમેરવું તે.
 ૫. સ્મૃતિઅંતર્ધાન = દિશાઓમાં જવા-આવવાનું ધારેલું માપ ભૂલી જવું તે.

ઉપરોક્ત અતિચારો (દોષો) વિનાનું આ છદ્રા દિગ્પરિમાણ વ્રત હું પાળીશ.

૭. ભોગોપભોગ વિરમણ પ્રત

(બીજું ગુણપ્રત)

ભોગ=અનેકવાર જેનો ઉપયોગ થાય તેવી વસ્તુ, જેમ રંધેલું ધાન્ય. ઉપભોગ=વારંવાર જેનો ઉપયોગ થાય તેવી વસ્તુ. જેમ કે કપડાં, દાગીના, સ્ત્રી વિગેરે. વિરમણ=ત્યાગ. આવશ્યકતા વિનાના ભોગ-ઉપભોગનો ત્યાગ.

હું મારા છુવનમાં ભોગની સામગ્રી.....દિમતથી વધારે અને ઉપભોગની સામગ્રી.....દિમતથી વધારે રાખીશ નહિ. અને આ પ્રતના અનુસંધાનમાં ધડાં પાપ કરાવનારા એવા ૧૫ કર્માદાનના વેપારો (ધંધાઓ) શક્ય બનશે તેટલા ત્યજ દર્દીશ. (કરીશ નહિ), આ પ્રત પાળવામાં નીચેના નિયમો પથાશક્તિ પાળીશ. નિશાની શક્યાનતેમાં અને ન પાળી શક્ય તેમાં નિશાની કરવી.

1. દિવસમાં ૧ વાર, ૨ વાર કે ૩ વારથી વધારે વાર ભોજન કરીશ નહિ.
2. પ્રત્યેક ટેકના ભોજનમાં ૫/૬/૭ અથવા યથોચિત દ્રવ્યોથી વધારે પદાર્થોનું ભોજન કરીશ નહીં.
3.જોગીથી વધારે કપડાં સ્ટોકમાં રાખીશ નહિગ્રામથી વધારે દાગીના સોનાના રાખીશ નહીં તથા ચાંદીના દાગીના.....ગ્રામથી વધારે અને અન્ય જાવેરાતના દાગીના.....દિમતથી વધારે રાખીશ નહિ.

૪. દરરોજ ચૌદ નિયમો ધારીશ. સાંજે-સવારે તે નિયમો સંકેપીને બીજા નિયમો ધારીશ.
૫. બીડી-સીગારેટ, તમાકુ-હોકી, શુટકા, માવા, પાન, ભસાલા, માણેકચેંદ, સોપારી, ચરસ, અઝીશ, બ્રાઉનસુગર વિગેરનો ઉપયોગ કરીશ નહિ.
૬. મદિરાપાન, વેશ્યાગમન, શિકાર અને જુગારનાં પાપો કરીશ નહિ.
૭. રાંધેલું વાસી અનાજ રાખીશ નહિ, ખાઈશ નહિ, રાત્રિ-ભોજન કરીશ નહિ. (રાત્રે જમવું જ પડે, એવી આજીવિકા હોય તો રાત્રે એક વાર જમ્યા પછી નહિ જમું.)
૮. અનંતકાય (કંદમૂળ)નો સર્વથા ત્યાગ રાખીશ.
૯. અભય વસ્તુઓનું લક્ષણ કરીશ નહિ અથવા ૧-૨-૩ વસ્તુ વિના બીજાં અભય પદ્ધર્થો ખાઈશ નહિ.
૧૦. ઈંડા ખાઈશ નહિ, વેચીશ નહિ, ફોડીશ નહિ.
૧૧. આર્ડી નક્ષત્ર પછી કેરીનો ત્યાગ કરીશ. કોબીજ, ફુલાવર તથા તેનાં શાક ખાઈશ નહિ.
૧૨. ચરબી અને ઈંડાના રસવાળી ચોકલેટ, ટેટબરી ખાઈશ નહિ.
૧૩. કાચા દૂધ-દહીની સાથે કઠોળ કે તેની બનાવટનો ઉપયોગ કરીશ નહિ.
૧૪. હું ડૉટલનું ખાઈશ નહિ. બજારનું ખાઈશ નહિ, ઉભા ગેલા ખાઈશ નહિ.

૧૫. ફિટીલાઈઝર દવાઓનો ઉપયોગ કરીશ નહિ. કેરોસીન, પેટ્રોલ, ડિજલ અને ગેસ વેચવાનો ધંધો કરીશ નહિ. ચરબીવાળા સાબુ, ટૂથપેસ્ટ વિગેરેને વેચવાનો ધંધો કરીશ નહિ તથા તેવી વસ્તુઓ હું વાપરીશ નહિ.
૧૬. હું બ્રેડ, પાઉં, ટોસ, સેન્ડવીચ, પાઉંભાજી ખાઈશ નહિ.
૧૭. હું માછલાં, પકડવાની જાળ વેચવાનો ધંધો કરીશ નહિ, પોપટ તથા ઉદર આદિનાં પાંજરાં વેચવાનો ધંધો કરીશ નહિ તથા મત્સ્યોધાળ કરીશ નહિ.

સાતમું પ્રત બરાબર પાળવા માટે ૨૨ અભક્ષ્ય, ઉર અન્તંકાય, ૧૪ નિયમો અને ૧૫ કર્માદાન સમજવા જરૂરી છે. તે સર્વેનું ટુંકાણમાં સ્વરૂપ આ પ્રમાણે છે :-

૨૨ અભક્ષ્ય

૧. માંસ : માંસ, ઈડા, માછલી, કોડલીવર ઓઈલ.
૨. મધ : માખીઓનું, ભમરાઓનું, કુત્તિયનું (એક પ્રકારનું કૃદ્ર જન્મનું) મધ,
૩. માખજા : દલીને વલોવીને કાઢેલું, (છાશમાં ડૂબેલ માખજા અભક્ષ્ય ન ગણાય.)
૪. માદિરા : દારૂ, ચરસ, ગાંઝો ભાઉનસુગર, તમાકુ, વિગેરે.
૫. જેર : સોમેલ, વચ્છનાગ, હરતાલ, પોટાશીયમ, અફીલ વિ.
૬. બહુબીજ : જેનો ગર્ભભાગ (ખાદ્યભાગ) જુંદો ન પડી શકે તેટલાં બધાં બીજવાળી વસ્તુ, જેમ કે ખસખસ, અંજીર, જામફળ વિગેરે.

૭. બોળો : ચાસણી, તડકા આપ્યા વિનાનાં અથારાં, ત્રણ દિવસ પછીનાં રાયતાં ચટણી વિગેરે.
૮. દ્વિદળ : કાચા દૂધ, દહી અને છાશ સાથે કઠોળ, ગવાર, કુમટીઆ ખાવા તે.
૯. તુચ્છજળ : જેમાં ખાવાનું થોડું હોય અને ફેંકી દેવાનું વધારે હોય તે, જેમકે ચણીબોર, પીચુ, પીલુ, શાલસા, સીતાકળ.
૧૦. અજાણ્યાં ફળ : કોઈ ન ઓળખી શકે તેવાં અર્થાત્ અજ્ઞાત ફળ.
૧૧. રાત્રિભોજન : સૂર્યસંતથી જોખા દિવસના સૂર્યોદય પૂર્વે અંધકારમાં ભોજન કરવું તે.
૧૨. ચલિતરસ : જે ભોજનનાં રૂપ રસ બદલાઈ ગયાં હોય તે. ઉત્તરી ગયેલું ભોજન.
૧૩. કરા : ઉંબરો-કાલુંબર વિગેરે.
૧૪. પીપળો : એક પ્રકારનું વૃક્ષ, પીપળો, વડનાં ફળ.
૧૫. માટી : કાચી માટી.
૧૬. રીગણા : રીગણાં તથા રીગણાંની જાતિ.
૧૭. બરફ : બરફ, મશીનનો આઈસ, આઈસ્ક્રીમ, ગુલ્ફી વિગેરે.
૧૮. મૂળા : મૂળા તથા મૂળાની ડાંડલી-પાંદડા વિગેરે અંગો.
૧૯. કેરી : આર્ડ્રા નક્ષત્ર બેઠા પછી કેરી આપ્રફળ.
૨૦. અધાર ચાતુર્માસ : અધાર સુદ ૧૪ પછી પંદર દિવસથી અધિક કાળની મીઠાઈ, લોટ વિગેરે.

૨૧. કારતક ચાતુર્માસ : કારતક સુદ ૧૪ પછી એક માસથી અધિક કાળની મીઠાઈ, લોટ, ખાખરા વિગેરે.
૨૨. ફાગણ ચાતુર્માસ : ફાગણ સુદ ૧૪ પછી વીસ દિવસથી અધિક કાળની મીઠાઈ લોટ, ખાખરા વિગેરે તથા કાજુ-દ્રાક્ષાદિ મેવા વિગેરે. આ બાવીસ પદાર્થો અભક્ષ્ય (ખાવાને માટે અયોગ્ય જાણવા)

૩૨ અનંતકાય

૧. આદુ, ૨. બટાટાં, ૩. કાંદા, ૪. લસડા, ૫. ગાજર, ૬. સૂરણા, ૭. સક્કરીયાં, ૮. રતાળુ, ૯. પીડાળુ, ૧૦. મૂળકંદ, ૧૧. વજકંદ, ૧૨. હીરલીકંદ, ૧૩. ઘીરસુઆ કંદ, ૧૪. ઘીલોડા, ૧૫. લોઢી, ૧૬. શરમર, ૧૭. થેગ, ૧૮. લીલો કચુરો, લીલી હળદર, લીલી મોથ, લીલી ગળો, ૧૯. લુણીની છાલ, ૨૦. લુણીવાંસ, ૨૧. કારેલી, ૨૨. કુણી આંબલી, ૨૩. કુમારપાઠાં, ૨૪. થોરની જાતિ, ૨૫. શતાવરી, ૨૬. લૂભિકોડા, ૨૭. વત્થુલાભાજી, ૨૮. પાલકભાજી, ૨૯. મુઅરવેલ, ૩૦. સેવાલ, ૩૧. કુણી વનસ્પતિ, કુણા અંકુરા અને કુણાં ફળો તથા ૩૨. ડિસલય (કુપળો) વિગેરે વસ્તુઓ અનંતકાય છે.

અનંતા જીવો એક શરીરમાં જ્યાં ૨હે તે અનંતકાય. (આ અનંતકાયને કંદમૂળ અને સાધારણ વનસ્પતિકાય પણ કહેવાય છે. તે જીવનભર ત્યા દેવાં જોઈએ, તથા અનંત જીવો જ્યાં નથી પરંતુ ઘણા જીવોની હિંસા હોવાથી તામસી પરિણાતિ થતી હોવાથી અને આરોગ્યને નુકશાનકારક હોવાથી ખાવાને માટે જે અયોગ્ય છે તે અભક્ષ્ય.) શક્ય હોય ત્યા સુધી સર્વ અભક્ષ્ય પણ ત્યા દેવાં જોઈએ.

હવે ચૌદ નિયમો પ્રતિદિન ધારવાના આ પ્રમાણે છે :-

૧. સચિત : જીવવાળી વસ્તુ તે સચિત, હું આજે સચિત વસ્તુનો સર્વથા ત્યાગ કરીશ. અથવા.....થી વધુ સચિત વસ્તુ વાપરીશ નહીં.
૨. દ્રવ્ય : ખાવા લાયક પદાર્થ. હું આજે.....દ્રવ્યોથી વધારે દ્રવ્યો વાપરીશ નહીં.
૩. વિગઈ : વિકાર કરે તે. નરકાદિ ગતિમાં લઈ જાય તે વિગઈ કહેવાય. માંસ, મધ, માખજા અને મહિરા આ ચાર મહાવિગઈનો હું જીવનભર ત્યાગ કરે છું. અને ઘી, તેલ, દૂધ, દહી, ગોળ અને તપેલું. આ છ લઘુવિગઈ છે. આ છ વિગઈઓમાંથી આજે હું.....વિગઈનો ઉપયોગ કરીશ નહિં.
૪. વાણાઇ : ઉપાનાઇ : ચંપલ, બૂટ, સેંડલ, પગરખાં મોજાં વિગેરે હું આખા દિવસ દરમ્યાન (અથવા રાત્રિ દરમ્યાન).....જોડીથી વધારે ચંપલાદિનો ઉપયોગ કરીશ નહિં.
૫. તંખોલ : મુખવાસ, હું આજે.....ગ્રામથી વધારે મુખવાસ લઈશ નહિં.
૬. વસ્ત્ર : હું આજે.....જોડીથી વધારે વસ્ત્રો પહેરીશ નહિં.
૭. કુસુમ : હું આજે.....ગ્રામથી વધારે વસ્તુઓ સુંધીશ નહિં.
૮. વાહન : હું આજે.....થી વધારે મોટર, ટ્રેન, ઘોડાગાડી કે રીક્ષા વિગેરે વાહનનો ઉપયોગ કરીશ નહિં.

૮. શયન : હું આજે બેસવા માટે અને સુવા માટે.....થી
વધારે બેઠક-શાયાનો વપરાશ કરીશ નહિ.
૧૦. વિલેપન : શરીરે લગાડવાની વસ્તુઓ જેમ કે તેલ, પાવડર
વિગેર, હું આજે.....ગ્રામથી વધારે વસ્તુઓ વાપરીશ નહિ.
૧૧. બ્રહ્મચર્ય : હું આજે દિવસે બ્રહ્મચર્ય પાળીશ. રાત્રે પણ
બ્રહ્મચર્ય પાળીશ. અથવા સ્વદારાસંતોષી થઈને રહીશ.
૧૨. દિશા : હું મારા નિવાસસ્થાનથી ચારે દિશા ચારે વિદિશા,
ઉપર અને નીચે.....કિલોમીટરથી વધારે
ગમનાગમન કરીશ નહિ.
૧૩. સ્નાન : હું આજે.....થી વધારે વાર સ્નાન કરીશ નહિ.
૧૪. ભોજન : જણો ટેકનું મળીને ચુલ આજે ભોજન હું.....
કિલોથી વધારે કરીશ નહિ.
- પૃથ્વીકાય :** કાચુ મીઠું, હાથ ધોવા માટેની માર્ટી વિગેર
મળીને હું આજે.....ગ્રામથી વધારે પૃથ્વીકાયનો
ઉપયોગ કરીશ નહિ.
- અખાય :** પીવામાં.....ગ્રામથી વધારે પાણીનો ઉપયોગ
કરીશ નહિ. ન્હાવામાં.....ડોલથી વધારે પાણીનો
ઉપયોગ કરીશ નહિ. કપડાં ધોવામાં તથા વાસણા
માંજવામાં ઓછું પાણી વપરાય તેનો ઉપયોગ રાખીશ.
નદી, તળાવ, સરોવર અને સમુદ્ર જેવા બહોળા પાણીમાં
સ્નાન અને વસ્ત્ર ધોવણ કરીશ નહિ.
- તેઉકાય :** આજે હું.....લાઈટ,.....ચુલા, અથવા..... ઘરની
લાઈટ ચુલાથી વધારે અજિનનો વપરાશ કરીશ નહિ. તથા
ટીવી, ફોઝ, વોશીગમશીન, ઘરઘંટી, હીટર ટેપરેકર્ડ આહિમાં
શક્ય બનશે તેટલી અજિનકાયની ડિસા ઓછી કરીશ.

વाउकाय : હું આજે થી વધારે પંખા, થી

વધારે છિંચકા, થી વધારે એરકંડીશનનો ઉપયોગ

તથા થી વધારે ચાલણીનો વપરાશ કરીશ નહિ.

વનસ્પતિકાય : ફળ, ફુટ, શાક, ભાજુ વિગેરે સર્વે

મળીને કિલોથી વધારે વનસ્પતિનો ઉપયોગ

કરીશ નહિ.

અસિ : છેદવાનાં સાધન જેમ કે સોય, કાતર, છરી, ચખ્પુ,

શસ્ત્ર, બ્લેડ, ટાંકણી વિગેરે. આજે હું સર્વે મળીને થી

વધારે આ સાધનોનો ઉપયોગ કરીશ નહિ.

માસિ : લખવાનાં સાધન જેમ કે પેન, બોલપેન, પેન્સિલ,

ચોક વિગેરે. આજે હું સર્વે મળીને થી વધારે

આ સાધનોનો ઉપયોગ કરીશ નહિ.

કૃષિ : ખેતીનાં સાધનો જેમ કે હળ વિ. હું આજે ખેતીનું કાર્ય

કરીશ નહીં. અથવા થી વધારે સાધન વાપરીશ નહિ.

ચૌદ નિયમોની સાથે પાંચ કાયની હિસાનું પરિમાશ

તથા અસિ-મસિ અને કૃષિનું માપ ધારવું જરૂરી છે. આ ચૌદ

નિયમો એક દિવસ પુરતા સવારે ધારવાના, સાંજે વાપરેલી

વસ્તુઓને યાદ કરી જેટલી વસ્તુ ન વાપરી હોય તેટલી

વસ્તુઓ લાભમાં એમ બોલીને સંકેપવું. એ જ રીતે રાત્રિના

નિયમો વિષે સવારે સંકેપવાનું સમજવું. એમ પ્રતિદિન આચરવું.

આ છુબમાં જેનાથી ઘણાં વધારે કર્મો બંધાય તે કર્માદાન

એવાં ૧૫ કર્માદાન છે. તે શક્ય હોય ત્યાં સુધી છુબનભર વર્જુ

દેવાં જોઈએ. અથવા ન જ વર્જુ શક્ય તેવાને બકાત કરી શેષ

આ કર્માદાનો ત્યાં દેવાં જોઈએ. તે આ ગ્રમાઝો :-

૧૫ કર્માદાનો

૧. ઈંગ્રાલકર્મ : અજિની લઢીઓ ચલાવવી પડે તેવાં લોખંડ, પીતળ, તાંબુ વિગેરે ધાતુઓ ઓગાળવાનો, કોલસા પાડવા, ઈંટો પકવવી, નળીયાં પકવવાં, કાચ બનાવવા ઈત્યાહિ વેપારો તે પ્રથમ કર્માદાન.
૨. વનકર્મ : જંગલોમાં વૃક્ષો કાપવાં, ભાળવાં, લાકડાં કાપવાં-લાવવાં-વેચવાં, માળી-ઘેડૂત-કઠીયારાનો ધંધો કરવો.
૩. શક્તકર્મ : ગાડાં-બળદ-સ્કૂટર-સાઈકલ-મોટર વિગેરે વાહનો લેવાં-વેચવાં.
૪. ભાટકકર્મ : ગાડાં, ધોડા, ઊંટ, બળદ ધાડા વિગેરે પશુઓ ભાડુ મેળવવા આપવાં અથવા તેના દ્વારા ભાડુ મેળવવાનો ધંધો કરવો. તથા મોટર, ટ્રક; ટેમ્પો વિગેરે ભાડે ફેરવવા, ભાડે આપવા વિગેરે.
૫. સ્ફોટકકર્મ : ફૂવા, વાવ, તળાવ વિગેરે ખોદવા, ખોદાવવાં, તથા ભરેલાં તળાવ વિગેરે ખાલી કરવાં-કરાવવાં આવા કાર્યો કરવાનો ક્રોન્ટાકટરનો ધંધો કરવો તે.
૬. દંત વેપાર : હાથીદાંત, શિંગડાં તથા મોતી વિગેરેનો વ્યાપાર.
૭. લાખવેપાર : લાખ, કુસુંબો, હડતાળ વિગેરેનો વ્યાપાર.
૮. રસવેપાર : ધી, તેલ, ગોળ, દૂધ, દહીનો વેપાર.

૯. કેશવેપાર : ધેટાં, બકરાં, વિગેરેના વાળનો (ઉનનો) વેપાર, મોર, પોપટ વિગેરેના પીછાનો વેપાર કરવો તે.
૧૦. વિષવેપાર : અફીઝા, સોમલ, બીડી, તમાકુ, સીગારેટ, દારુ વિગેરેના વેપારો કરવા તે.
૧૧. યંત્રપીલનકર્મ : ઘંટી, ચરખા, ધાડી અને ભીલ ચલાવવી.
૧૨. નિર્લાંઘનકર્મ : ઉટ, બળદ, છોકરા, છોકરી વિગેરેનાં નાક-કાન વિંધવાં. તથા અંગચેદ કરવો તે.
૧૩. દવદાનકર્મ : જંગલ, ઘર બાળવું, કચરો બેગો કરી સણગાવવો. ઘાસ કે વનસ્પતિ સણગાવવી.
૧૪. સરદ્રહંતડાગશોષ : સરોવર, દ્રષ્ટ, તળાવ, ઝૂવા શોષવા, સુકવવા, ખાલી કરવા, એકનું પાણી બીજામાં નાખવું વિગેરે.
૧૫. અસતીપોષણ : ઝૂતરાં, બીલાડાં, વિગેરે હિસ્ક પ્રાણીઓને પાળવાં તથા દુરાચારી જીવનું પોષણ કરવું તે.

ઉપર કહેલાં ઉર અનંતકાય હું કાયમ માટે ત્યજી દઉં છું. ૨૨ અભક્ષ્ય પણ ત્યજું છું. અથવા ૧-૨-૩ અભક્ષ્ય વિના શેખને ત્યજી દઉં છું. દરરોજ સવારે અને સાંજે ચૌદ નિયમો ધારીશ. અને આ પંદર કર્માદાનોના વેપારોને છોડી દઈશ. જો આ પન્નરમાના કોઈ એકાદ વેપાર વિના મારી આજીવિકા ચાલે તેમ નહીં હોય તો તેની જ્યથાા. આવા નિયમવાળું આ સાતમું ક્રત હું પાળીશ. તથા નીચેના પાંચ અતિચારો (દોષો) નહીં લગાડું.

न सेववा धोग्य पांच अतिचारो

१. सचित्तआहार = ज्ञववाणी जे वस्तु ते सचित्त, तेनो आहार करवो ते, जेमके दाउम, लीबु, केरी, काचु भींडु, पपैयु, काकडी, टामेटो, लींडा काचु पाणी विगेरे.
२. सचित्तसंबद्धआहार = सचित्तनी साथे संबंधवाणु खावुं ते. जेम के बोर.
३. सचित्तसंमिश्रआहार = सचित्तथी मिश्र करेल आहाराहि वापरवो. जेमके लीबुना रसथी मिश्र करेलां दाण-शाक विगेरे.
४. अभिषबआहार = वासी आहार, बोण, अथाणु, विगेरे खावुं. माहिरा आहि माईक पदार्थानो आहार करवो. विविध पदार्थाना मिश्रजाथी तैयार थयेल माहिरा आहि विकारक पदार्थानुं सेवन करवुं.
५. दुष्प्रक्वआहार = बराबर नहीं रंधायेलो काचो-पाडी आहार खावो ते.

उपरना पांचे अतिचारो त्यज्ञने हुं आ प्रत पाणीशः

जैन साईट

C. અનર્થદંડ વિરમણ પ્રત

(ત્રીજું ગુણવ્રત)

અનર્થ=બીજજરૂરી, આવશ્યકતા વિનાનું. દણડ= ૫૧૫,
તેનું વિરમણ=ત્યાગ.

જીવન જીવવામાં જે જે પાપો બિનજરૂરી છે. એટલે
કે જે જે પાપો કરવાં આવશ્યક નથી. ન કરીએ તો પણ
ચાલે તેમ છે. આનંદ ચેમન, માન અને મોખા માટે જે જે
પાપો કરાય છે તેવાં પાપોને. અનર્થદંડ કહેવાય છે. તેવાં
બિનજરૂરી પાપોથી અટકવું તેનો ત્યાગ કરવો અથવા પ્રમાણ
કરવું તેને અનર્થદંડ વિરમણ પ્રત કહેવાય છે. આ પ્રત નીચેના
નિયમોથી હું જીવનભર પાળીશ.

૧. આપધાત, ખૂન અને સેક્સસી વિચારો હું કરીશ નહીં
અને તે પાપો કરવાના વિચારો આવશે તો સાચા
હિતોપદેશકનું શરણું લઈશ.
૨. હું છૂટાછેડા લઈશ નહીં. આપીશ નહિ-અપાવીશ નહિ,
આપવાની સલાહ આપીશ નહિ. તથા પુનર્લગ્નની પણ
સલાહ આપીશ નહીં. લવમેરેજ, કોઈ લગ્ન, કુટુંબ
નિયોજન તથા તેના સાપનોનો ઉપયોગ કરીશ નહિ-
કરાવીશ નહિ. અને તેમ કરવાની કોઈને સલાહ આપીશ
નહિ.

૩. રાત્રિભોજન કરાય, બટાકા- કુંગળી-લસડા વિગેરે કંદમૂલ ખવાય, M. C. માં બધાં જ કામો થાય. ઈત્યાદિ ભગવાનની આશાધી વિરુદ્ધ પાપકાર્યો કરવાનો ઉપદેશ આપીશ નહિ. અપાવીશ નહિ અને આવા વિરુદ્ધ ઉપદેશ આપનારને ચલાવી લઈશ નહિ. (સહન કરી લઈશ નહિ.)
૪. ધર્મી ડિસાવાળા ડિસ્ક ધંધાઓ કરવાનો ઉપદેશ, સલાહ કે શિખામણ આપીશ નહિ.
૫. લોટરીની ટીકીટ, પેસાની શરતો, સર્કો, ગંજપતાની રમત, જુગાર, પશુ-પક્ષીઓને લડાવવાં, મારવાં, શૂટ કરવાં, તથા તેવાં ડિસ્ક કાર્યોની ટી. વી., વિડીઓ જોવી. મટકાના આંકડા લગાવવા. નવરાત્રિના ડીસ્કો દાંડીયારાસનું આયોજન કરવું. તથા જોવું. ગરબા, ડાન્સ, આ બધાં કાર્યો કરીશ નહિ. કરાવીશ નહિ અને જોઈશ પડા નહિ.
૬. છોળી-ધૂળેટી વિગેરે પર્વોમાં રંગથી રમીશ નહિ. કોઈની ઠકા મશકરી-મજાક કરીશ નહિ. ફટકડા ફોડીશ નહિ, વેચીશ નહિ, ઘરમાં હીરો અને હીરોઈનનાં કેલેન્ડર રાખીશ નહિ. બિલત્સ અને અર્ધનરી ચિત્રો પાસે રાખીશ નહિ અને ઘરની દિવાલોમાં લગાવીશ નહિ.
૭. નાટક, સિનેમા, તમાસા, સરકસ, જીવનભર જોઈશ નહિ અથવા એક માસમાં.....થી વધ્યારે જોઈશ નહિ.

૮. પતંગ ચગાવવાનું, ડિકેટ મેચ જોવાનું, ડિકેટ રમવાનું, કોમેન્ટ્રી સાંભળવાનું વિગેરે આ કાર્યો હું કરીશ નહિ. અથવા ૧ દિવસમાં.....કલાકોથી વધારે સમય તેમાં ગાળીશ નહિ.
૯. ઉપરના કાર્યોની (એટલે કે ડિકેટ મેચ વિગેરેની) શરત લગાવીશ નહિ. જુગાર ખેલીશ નહિ.
૧૦. ટી. વી., વીડીયો વસાવીશ નહિ અથવા કદાચ વસાવવું પડે તો પડ્ય દેશના મુખ્ય મુખ્ય સમાચારો સિવાય જોઈશ નહિ-વગાડીશ નહિ. તથા કેબલ-ડિસ્કનું કનેક્શન લઈશ નહિ. તેનો વ્યવસાય કરીશ નહિ.
૧૧. કોઈ પાપકાર્ય થઈ જ ગયું હોય તો પાછળથી તેની પ્રશંસા કરીશ નહિ. પરંતુ તેનો પસ્તાવો કરી આલોચના લઈશ.
૧૨. કોઈ પુણ્યકાર્ય મેં કર્યું હોય તો પાછળથી તેનો પસ્તાવો કે નિંદાનું કાર્ય કરીશ નહિ. પરંતુ અનુભોદના કરીશ.
૧૩. કોઈની નિંદા, ઠકા, મશકરી, મજાક, કર્કશ વચ્ચનો બોલવાં. વંગ-કટાક્ષ-મેણાં-ટોણાં બોલવાં. આવાં પાપો કરીશ નહિ.
૧૪. ગુસ્સો કરીશ નહિ. છતાં થઈ જાય તો.....રૂપિયા શુભ ભાતામાં વાપરીશ.
૧૫. દિવસે ઊંઘીશ નહિ. અથવા.....થી વધારે કલાક ઊંઘીશ નહિ.
૧૬. રાત્રે.....કલાકથી વધારે ઊંઘીશ નહિ.

૧૭. અયુગીયમ જોવા જવું, કુકડાનું યુદ્ધ, મહલયુદ્ધ અને ઘોડાના રેસ જોવા જવું ઈત્યાદિ કાર્યો કરીશ નહિ. તથા તેની શરતો લગાવીશ નહિ.
૧૮. પર્વતિથિ, બે નવપદની ઓળી, પર્યુષણ પર્વ, ત્રણ ચેમાસીની અઙ્ગાઈ ઈત્યાદિ મોટા દિવસમાં દળવાનું, ખાંડવાનું, પીસવાનું કે કપડાં ઘોવાનું, સાલુથી સાન કરવાનું ઈત્યાદિ કાર્યો કરીશ નહિ.
૧૯. આપ આપવાનું, હિંચોળ હિંચવાનું કાર્ય કરીશ નહિ.
૨૦. કોઈની પણ ઘ્યાતિ સાંભળી અદેખાઈ કરીશ નહિ. માટી, મીઠું, અનાજ વિગેરે ઉપર પ્રયોજન વિના ચાલીશ નહિ. તેના ઉપર બેસીશ નહિ.
૨૧. જેના ઉપર રાગ હોય તેની આબાદી-ચડતી-અકઢિ ઈચ્છવાનું અને જેના ઉપર દ્વેષ હોય તેના મૃત્યુની, પડતીની અને નુકશાન થવાની ઈચ્છાઓ કરીશ નહિ.

ઉપરના નિયમો યથાશક્તિ પાળવા પૂર્વક આ આઠમું ગ્રત હું પાળીશ. તેમાં નીચેના પાંચ અતિચારો (દોષો)લગાડીશ નહિ.

- (૧) કંઈપુર : કામવાસના ઉતોજક વચનો બોલવાં, વાસનાવાળી વાર્ષા બોલવી તથા મશકરી કરવી.
- (૨) કૌકુચ્ય : કામવાસના ઉતોજક આંખના મુખના અને શરીરના હાવભાવ કરવા. આંખ મેળવવી. ચુંબન કરવું, વાસના વર્ધક અંગો જોવાં.

- (૩) ભૌખર્ય : વાચ્યાળપણે ધ્યાન, બોલવું, કોઈની પછી પાડવી.
- (૪) અસમીક્ષાધિકરણ : વિચાર કર્યા વિના ચઘુ, છરી, ખાંડળીયો કિગરેન હિસાનાં સાથનો વધારે વધારે બેગાં કરવાં.
- (૫) ઉપભોગાધિકત્વ : શરીરની ટાપટીપ, શોભા શણગાર, ધડાં કરવાં અને તેનાં સાથનો જરૂરિયાત કરતાં અધિક રાખવાં.

ઉપરના અતિચારો (દોષો) લગાડવા વિના આ આઠમું પ્રત હું પાળીશ.



૮. સામાયિક પ્રત

(પહેલું શિક્ષાપ્રત)

સામાયિક = આત્માને સમભાવમાં લાવવો, તેના માટે કરાતું પ્રત.

હું દર મહિનામાં સામાયિક અને પ્રતિકમણ એમ બને સાથે મળીને કુલ.....સામાયિક કરીશ. જો તે સંઘ્યા તે માસમાં પૂરી ન થાય તો બાકી રહી ગયેલાં સામાયિકો તથા તેટલાં જ તેના દંડરૂપે અધિક સામાયિકો એમ બમજાં બીજા મહિનામાં રહી ગયેલા પેટે કરી આપવાં. આ સામાયિક પ્રત પાળવામાં નીચેના નિયમો યથાર્થકિંત પાળીશ.

૧. દરેક સામાયિકમાં નવી ગાથાઓં ગોખીશ, અને જૂની ગાથાઓનો સ્વાધ્યાય કરીશ.
૨. વાઉકાય જીવોની રક્ષા માટે મુહૂરતિ અને ભૂમિ ઉપર હરતા-ફરતા જીવોની રક્ષા માટે કટાસણું અને ચરવાળાનો સારી રીતે ઉપયોગ કરીશ.
૩. ત્યાગ અને આર્ય સંસ્કૃતિ દર્શક ધોતી-ખેસ આદિ વેશ સામાયિકમાં રાખીશ. સ્ત્રીઓનો આશ્રયી સાડીનો વેશ ઈત્યાદિ સમજી લેવું.
૪. સામાયિકમાં સાંસારિક વાતો કરીશ નહિ, લેવા અને પાળવાનો સમય બરાબર ધ્યાનમાં રાખીશ. ભીત વિગરેનો ટેકો દઈશ નહિ.

૫. ઇલેક્ટ્રોનિક ઘડીયાળ સામાયિક કાળે પહેરીશ નહીં કે અડકીશ નહિ.
૬. શરીર ઉપર ઘણો શહૂગાર કે ઘણા દાળીના પહેરીશ નહિ.
૭. સામાયિકમાં સમતાભાવ બરાબર રાખી સ્વાધ્યાય કરીશ અથવા સ્વાધ્યાય સાંભળીશ. પરંતુ નીચે મુજબના મનના-૧૦, વચનના-૧૦ અને કાયાના -૧૨ દોષો હું સેવીશ નહિ તથા પાંચ અતિચારો લગડીશ નહિ.

મનના દશ દોષો : ૧. શત્રુને જોઈને તેના ઉપર દેખ કરવો. ૨. અવિવેક ચિંતવવો. ૩. તત્ત્વનો વિચાર ન કરવો. ૪. મનમાં ઉદ્દેશ ધરવો. ૫. યથની ઈચ્છા કરવી. ૬. વિનય ન કરવો. ૭. ભય ચિંતવવો. ૮. વિચારના ચિંતવવો. ૯ ફળની શંકા કરવી. ૧૦. નિયાંદું કરવું. આ મનના ૧૦ દોષો જાણવા.

વચનના દશ દોષો : ૧. હલકાં વચનો બોલવાં, ૨. હુંકારા કરવા, ૩. પાપવાળાં કાર્યો કરવાનો આદેશ આપવો, ૪. લવારો કરવો, ૫. કછ્યો કરવો, ૬. “કેમ છો ? મજામાં છો ને” આ પ્રમાણે ક્ષેમકુશળ પૂછી આગતા-સ્વાગતા કરવી. ૭. ગાળ દેવી. ૮. બાળક રમાડવું, ૯. વિકથા કરવી, ૧૦. હંસી કરવી. (મશકરી કરવી.) આ વચનના ૧૦ દોષો જાણવા.

કાયાના બાર દોષો : ૧. આસન વારંવાર ફેરવવું, ૨. ચૌતરફ જોયા કરવું, ૩. સાવદ્ય (પાપવાળું) કાર્ય કરવું,

૪. આળસ ભરડવી, ૫. અવિનયે બેસવું, ૬. બીતાનું ઓઠીગણ
લઈને બેસવું, ૭. શરીર ઉપરનો મેલ ઉતારવો, ૮. ખજાજ
ખણવી, ૯. પગ ઉપર પગ ચઢાવવો, ૧૦. કામવાસનાને
કારણો બીજા લોકો દેખે તે રીતે અંગો ઉધાડાં રાખવાં, ૧૧.
જંતુઓના ઉપદ્રવથી ડરીને અંગો ઢાંકી રાખવાં, ૧૨. નિદ્રા
લેવી. આ કાયાના બાર દોષો જાણવા.

ન સેવવા યોગ્ય પાંચ અતિચારો

૧. મનદુષ્ટકાળિધાન = મનમાં ખોટા અને અનુચિત વિચારો
કરવા તે.
૨. વચ્ચનદુષ્ટકાળિધાન = વચ્ચનમાં ખોટાં, હલકાં અને કષાય
ભરેલાં વચ્ચનો બોલવાં તે.
૩. કાયદુષ્ટકાળિધાન = કાયાથી કુચેષ્ટા કરવી, અનુચિત
આચરણ કરવું.
૪. અનાદર = સામાયિકમાં ગુરુ અને સ્થાપનાચાર્ય આદિનો
અનાદર કરવો. ઉંચા આસને બેસવું, લાંબા પગ રાખવાં,
પગ ઉપર પગ ચઢાવવા વિગેરે.
૫. સ્મૃતિઅનુપસ્થાપન = સામાયિકનો સમય યાદ ન રાખવો, ભૂલી
જવો.

ઉપરોક્ત પાંચે અતિચારો અને મન-વચ્ચન-કાયાના
બગ્રોસે દોષોથી રહિત એવું આ સામાયિક પ્રત હું પાળીશ.



૧૦. દેશાવગાસિક પ્રત (બીજું શિક્ષાપ્રત)

દેશ = ક્ષેત્રનું, અવગાસ = માપ ધારવું, ક્ષેત્રના માપની ધારણાને દેશાવગાસિક કહેવાય.

આખા વર્ષમાં..... દેશાવગાસિક પ્રત કરીશ. હું જે દિવસે દેશાવગાસિક પ્રત કરું તે દિવસે દેરાસર અને ઉપાશ્રેયે જવાના કાર્ય વિના ઘરની બહાર કર્યાય જવું નહિ. દુનિયાથી દૂર થઈ જવું, સ્વાધ્યાપમાં અને આત્મ તત્ત્વના ચિંતનમાં લીન થઈ જવું, બહાર જવાની ભૂમિ સંકોપવી, હરવા-ફરવા માટેનું ક્ષેત્ર અત્યન્ત સંકોપવું, તે દેશાવગાસિક પ્રત કહેવાય છે. ઘણા લોકો બે પ્રતિકમણ અને આઠ સામાયિકને દેશાવગાસિક કહે છે. પરંતુ તે બરાબર નથી. “દુનિયાથી અલિપું થવા માટે દેશ=દિશાને-ક્ષેત્રને, અવગાસિક =માપ ધારીને ટુંકાવવું એ જ સાચુ પ્રત છે.” તેના પાંચ અતિચારો પણ આ અર્થને અનુસારે છે. ફક્ત સ્વીકારેલા ઉપરોક્ત પ્રતને (દિશાના નિયમને) પાળવા માટે તેના ઉપાયરૂપે બે પ્રતિકમણ, આઠ સામાયિક અને એકાસણાનું તપ કરવાનું છે. દિશાનો સંકોપ ધારવો તે પ્રત અને સામાયિક પ્રતિકમણ કરવાં તે આ પ્રત પાળવાના ઉપાયો છે.

આ દેશાવગાસિક પ્રત પાળતાં હું નીચેના નિયમો પાળીશ.

૧. આ પ્રતમાં ફોન લઈશ નહિ અને ફોન કરીશ નહિ.
૨. આ પ્રતમાં ટપાલ બહાર મોકલીશ નહિ અને બહારથી આવેલ ટપાલ વાંચીશ નહિ તથા છાપાં વાંચીશ નહિ.
૩. કોમ્પ્યુટર દ્વારા દેશ-વિદેશના સમાચારો આ પ્રત કાલે લઈશ નહિ, કોમ્પ્યુટર ચલાવીશ નહિ.
૪. પ્રત કાળે તેને બરાબર પાળવા માટે એકાસણાનું તપ, બે (સવાર-સાંજ) પ્રતિકમણ અને આઠ સામાચિક કરીશ.
૫. આ પ્રતના દિવસે નિરંતર સ્વાધ્યાય કરીશ, ગાથાઓ ગોખીશ, અધ્યાત્મના ગ્રંથો વાંચીશ અને વૈરાગ્યવર્ધક તત્ત્વચિંતન અને અનિત્યાદિ ભાવનાઓ ભાવીશ.
૬. ધરના સત્યો સાથે પડા પર્મચર્ચા વિના બીજો કોઈપણ વાર્તાલાપ તે દિવસે કરીશ નહિ.

આ પ્રત પાળવામાં નીચેના પાંચ અતિચારો (દોષો) હું લગાડીશ નહિ.

૧. આનયનપ્રયોગ : નિયમિતપણે ધારેલા ક્ષેત્રના પ્રમાણના બહારની ભૂમિથી અંદર કંઈ મંગાવવું તે.
૨. પ્રેષ્યપ્રયોગ : ધારેલા ક્ષેત્રના પ્રમાણની અંદરથી કોઈ પડા વસ્તુ ક્ષેત્ર પ્રમાણથી બહાર મોકલવી તે.
૩. શબ્દાનુપાત : ખોખારો, ઉધરસ, છીક, ખાઈને અથવા તાળી આદિ પાડીને શબ્દ કરવા દ્વારા ધારેલી ભૂમિથી બહાર-ઉલેલી વ્યક્તિનું ધ્યાન પોતાના તરફ દોરવું. અંદર બોલાવવો તે.

૪. રૂપાનુપાત : બારીમાંથી, અગાસ્તીમાંથી આપણું મુખ બહાર કાઢી ધારેલી ભૂમિથી બહાર ઉભેલા માણસને મુખ દેખાડવા દ્વારા તેનું ધ્યાન દોરવું તે.
૫. પુદ્ગલપ્રક્ષેપ : ધારેલી ભૂમિથી બહાર ઉભેલી વ્યક્તિ ઉપર પત્થર-કાંકરો અથવા બીજ ચીજ નાખીને તે વ્યક્તિનું ધ્યાન દોરવું અને ઈશારાથી અંદર બોલાવવો તથા કાચ વડે સૂર્યનો પ્રકાશ બહારની વ્યક્તિ ઉપર નાંખવો વિગેરે.

આ પાંચ અતિચાર દોષ લગાડવા વિના હું આ દેશાવગાસિકપ્રત પાળીશ.



૧૧. પૌષ્ઠોપવાસ વ્રત

(ત્રીજું શિક્ષાવ્રત)

પૌષ્ઠ = ધર્મની પુસ્તિ કરે, વૃદ્ધિ કરે તે, ઉપવાસવ્રત
= ઉપવાસપૂર્વકનું વ્રત.

આખો દિવસ, આખી રાત્રિ, અથવા આખો દિવસ અને રાત્રિમાં સાધુના જેવું જીવન જીવવું સાવદ્ધ (પાપવાળું) કાર્ય કરવું નહિ, સામાયિકનાં વસ્તુઓ પહેરો સામાયિક લેવાની વિધિ પ્રમાણે પૌષ્ઠ અને સામાયિક ઉચ્ચરીને આખો દિવસ (તેમાં કહેલી વિધિ પ્રમાણેની) ધર્મકિયામાં અને સ્વાધ્યાય-તત્ત્વચિંતન-મનન-વ્યાખ્યાન શ્રવણની ધર્મકાર્યોમાં સમય વ્યતીત કરવો. સચિતદ્રવ્યનો અને વિજ્ઞતીય વક્તિનો સ્પર્શો પણ સર્વથા કરવો નહિ. સંસારનો જાણે સર્વથા ત્યાગ કર્યો હોય તેમ તે દિવસ જ્ઞાન-ધ્યાન-તત્પ અને આરાધના સાધનામાં પસાર કરવો. તે પૌષ્ઠોપવાસ વ્રત.

આવા મ્રકારનું પૌષ્ઠોપવાસ વ્રત વર્ષમાં.....કરીશ.

આ વ્રત પાળવામાં હું નીચેના નિયમોને આધીન રહીશ.

૧. પૌષ્ઠવ્રતમાં સચિત વસ્તુનો અને વિજ્ઞતીય વક્તિનો સ્પર્શ કરીશ નહિ.

૨. પર્વતિથિઓ, બે આઠમ, બે ચૌદસ, સુદ પાંચમ વિગેરે દિવસોમાં તથા સંવચ્છરીના દિવસે, અથવા પર્યુષણા આઠ દિવસોમાં હું યથાશક્તિ પૌષ્ઠ પ્રત કરીશ.
 ૩. પૌષ્ઠ મોડો લેવાનું અને વહેલો પાળવાનું કામ કરીશ નહિ.
 ૪. પૌષ્ઠમાં પારણાની ચિંતા-વિચારણા કરીશ નહિ.
 ૫. પૌષ્ઠમાં જ્યાં-જ્યાં બેસવાનું, ઉભા રહેવાનું કે સંથારો કરવાનું હશે ત્યાં ત્યાં ભૂમિને બરાબર જોઈને તથા બરાબર પૂંજને જ કરીશ. **જૈન સાઇટ**
 ૬. મલ-મૂત્ર પડી ભૂમિને બરાબર જોઈને તથા બરાબર પૂંજને જ કરીશ.
 ૭. સમપ્રસર દેવવંદન-પરિલેહણ-પ્રતિકમણાદિ ધર્મકિયા કરીશ. અને તે સંપૂર્ણ સાવધાનીથી કરીશ.
 ૮. દિવસે ઉધવાનું કે આડા પડવાનું કે વિકદ્ધ આદિ કરવાનું કાર્ય કરીશ નહિ.
 ૯. નિરંતર ધર્મકિયા, વ્યાખ્યાન શ્રવણ તથા અધ્યાત્મશાસ્ત્રોનો સ્વાધ્યાય આદિ આરાધનાના કાર્યો કરીશ.
- નીચે મુજબના પાંચ અતિચાર દોષો આ પ્રતમાં લગાડીશ નહિ.

૧. અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિત ઉત્સર્ગ : ભૂમિ જોયા વિના અને પૂજયા વિના મલ-મૂત્ર પરઠવવાં. સંડાસ-બાથરુમનો ઉપયોગ કરવો.
૨. અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિત આદાનનિકોપ : ભૂમિ જોયા વિના અને પૂજયા વિના વસ્ત્રો-પાત્રો વિગેરે સર્વે વસ્તુઓ લેવી અને મૂકવી.
૩. અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિત સંસ્તાર ઉપકમણ : ભૂમિ જોયા વિના અને પૂજયા વિના આસન-શયન-બેઠક કરવી. સંથારો પાથરવો તે.
૪. અનાદર : પૌષ્યઘ્રતમાં ટેવ-ગુરુ અને ઘર્મનો અનાદર કરવો. આદર-બહુમાન ન કરવાં. વિવેક ન જાળવવો તે.
૫. સ્મૃતિઅનુપસ્થાપન : પૌષ્ય મોડો લેવો. વહેલો પાળવો. પૌષ્ય જ્યારે લીધો હોય ત્યારનો સમય ભૂલી જવો.

ઉપરના અતિચાર દોષો લગાડવા વિના આ પૌષ્યઘ્રત હું પાળીશ. વર્ષમાં.....પૌષ્ય કરીશ. જો તે સંખ્યા પ્રમાણે તે વર્ષમાં પૌષ્ય નહિ થાય તો બીજા વર્ષ તેના બદલામાં બાકી રહેલી સંખ્યાથી બમણા કરીશ. અને બીજા વર્ષના જુદા કરીશ. જો ધારેલી પૌષ્યની આ સંખ્યા નહિ પુરાય તો તેના દંડરૂપેરૂપીયા ઉત્તમ કાર્યોમાં ખર્ચિશ.



૧૨. અતિથિસંવિભાગ પ્રત (ચોથું શિક્ષાપ્રત)

અતિથિ=તિથિ જોઈને આવે એવો નિયમ નહીં. અર્થાત् વિહાર કરતા કરતા અચાનક પથારે તે અતિથિ એટલે પૂજ્ય સાધુ-સાધ્વીજી મ. સા. આદિ. સંવિભાગ=ભક્તિ કરવી તે બારમું પ્રત.

આ પ્રત કરનારને દિવસ અને રાત્રિનો પૌખણ કરવાનો હોય છે. ચઉવિહાર (ન બની શકે તો તિવિહાર) ઉપવાસ કરવાનો હોય છે. પારણામાં એકાસણું કરવાનું હોય છે. પારણાના પ્રસંગે પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબને વહોરાવીને (ભક્તિ કરીને) જ પારણું કરવાનું છે. પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજશ્રીની જે વસ્તુ વહોરવાથી ભક્તિ થઈ, તે જ વસ્તુ પારણામાં વાપરવાની છે. જેનાથી ભક્તિ થઈ શકી નથી તે વસ્તુ વાપરવાની નથી. આવું જે આ પ્રત તે અતિથિસંવિભાગ પ્રત કહેવાય છે.

આખા વર્ષમાં ૧-૨ અથવા..... અતિથિ સંવિભાગ પ્રત હું કરીશ. જો તે વર્ષમાં તે સંખ્યા પ્રમાણો ન થાય તો રહી ગયેલી સંખ્યા પ્રમાણો દંડ સાથે બીજા વર્ષમાં બમણા કરી આપીશ. અને બીજા વર્ષના અતિથિ સંવિભાગની સંખ્યા પણ જુદી ગણીને કરીશ. જો કોઈ કારણો નિયત સંખ્યા પ્રમાણો અતિથિ-સંવિભાગ નહિં જ થાય તો છેલ્લે..... રૂપિયા ઉત્તમ

કાર્યોમાં વાપરીશ. જો પારણાના પ્રસંગે પૂર્ણ સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબનો યોગ ન જ ભળી શકે તો પ્રતિધારી કોઈ ઉત્તમ શ્રાવક-શાચિકાને જમાડીને (ભક્તિ કરીને) એકાસણું કરીશ. આ પ્રત પાળવામાં હું નીચેના નિયમો બરાબર સાચવીશ.

૧. પારણાના પ્રસંગે પૂર્ણ મહારાજશ્રીને બહુમાનપૂર્વક ધરે લાવીશ અને બહુમાનપૂર્વક વહોરાવીશ.
૨. એક મહારાજશ્રી વહોરી ગયા પછી બીજા મહારાજશ્રી પદ્ધારશે તો પણ ભાવપૂર્વક વહોરાવીશ.
૩. તેઓશ્રી જે વસ્તુ વહોરશે. તે વસ્તુનો જ હું આહાર કરીશ.
૪. પૌષ્ઠ્રના કાળે પારણાની ચિંતા નહીં કરું.
૫. પૌષ્ઠ્ર પાણ્યા પછી અને પારણા પહેલાં જિનેશ્વર પ્રભુની ભક્તિ-સેવા ભાવપૂર્વક કરીને પછી ગુરુજીને વહોરાવીને એકાસણું (પારણું) કરીશ. આ પ્રતના નીચે મુજબ પાંચ અતિચારો લગાડીશ નહિ.

ન સેવવા યોગ્ય બારમા પ્રતના પાંચ અતિચારો

૧. સચિતનિક્ષેપ : વહોરાવવા યોગ્ય નિર્દોષ વસ્તુને ન વહોરાવવાની બુદ્ધિથી સચિત વસ્તુ ઉપર મૂકવી તે.
૨. સચિતપિધાન : વહોરાવવા યોગ્ય વસ્તુને ન આપવાની બુદ્ધિથી સચિત વસ્તુ વડે ઢાંકી દેવી તે.

૩. પરવ્યપદેશ : પોતાની વસ્તુને ન વહોરાવવાની બુદ્ધિથી પારકી કહેવી, અને પારકી વસ્તુને પોતાની કહીને વહોરાવી દેવી તે.
૪. માત્સર્ય : ઈર્ષા, મનમાં દાઝ, અન્તર્દ્વષ રાખીને વહોરાવવું.
૫. કાલાતિકમ : વહોરાવવાનો કાળ વીતી ગયા પછી બોલાવવા જવું.

આ પાંચ અતિચારો લગાડવા વિના આ બારમું અતિથિસંવિભાગ વ્રત હું પાળીશ.

જન સાઇટ

બારત્રતના અંતે સંલેખના વ્રત

સંલેખના = ટૂંકાવવું. સંસારની ઈચ્છાઓને ટૂંકાવવી. વ્રતોમાં રાખેલી છૂટછાટને ટૂંકાવવી. આહારાદિનો ત્યાગ કરવો.

મૃત્યુકાળ નજીક જણાય ત્યારે પાપોના આશ્રવને ઘટાડવા માટે વ્રતોમાં રાખેલી વિશાળ છૂટછાટને ટૂંકાવવી. અશનાદિ ચાર પ્રકારના આહારોમાંથી યથાશક્તિ ત્યાગ કરવો. બોગસુખો અને સાંસારિક પરિસ્થિતિઓને ત્યજી દેવી અથવા તે સુખોની ભમતા (ઈચ્છા) ત્યજી દેવી. વ્રતોમાં રાખેલી છૂટોને પણ દ્રવ્ય-ક્ષેત્ર કાળ અને ભાવથી ટૂંકાવી દેવી તે સંલેખના.

આ વ્રતના કાળે નીચેના પાંચ અતિચારો લગાડીશ નહિ. બારે વ્રતોની છૂટછાટને ટૂંકાવવા રૂપ આ સંલેખના વ્રત એ જુદુ વ્રત નથી પરંતુ બારે વ્રતના સમૂહરૂપ છે.

ન સેવવા યોગ્ય પાંચ અતિચારો

૧. ઈહલોક : ધર્મના પ્રભાવે આ ભવમાં સુખો ઈચ્છવાં તે.
 ૨. પરલોક : ધર્મના પ્રભાવથી પરભવમાં ઈન્દ્ર-હેવ-રાજુ અને ચક્રવર્તીપણાનાં સુખો ઈચ્છવાં તે.
 ૩. જીવિતાશંસા : સુખ આવે ત્યારે લાંબુ જીવન ઈચ્છિવું.
 ૪. ભરણાશંસા : દુઃખ આવે ત્યારે ભરણ ઈચ્છિવું.
 ૫. આશંસાપ્રયોગ: કામલોગના સુખોની (તીવ્ર) ઈચ્છાઓ કરવી.
- આ પાંચ અતિચાર દોષ લગાડ્યા વિના હું સંલેખના કરીશ.

જૈન સાઇટ

આ પ્રમાણે સમ્યકૃત સહિત બાર વ્રતો અને પંચાચારનું હું જીવનભર પાલન કરીશ. કોઈ દોષ લગાડીશ નહિ. અને જો કોઈ દોષ લાગી જાય તો ગુરુજી પાસે પ્રાયશિત લઈશ.

બારે વ્રતોના મળીને ૧૨૪ અતિચારો સેવીશ નહિ.

શાનાચારના	૮	સમ્યકૃતવ્રતના	૫	સ્થાનકવારી સંપ્રદાયમાં
દર્શનાચારના	૮	બાર વ્રતોના	૬૦	બારવ્રતોના ૬૦ અને
ચારિત્રાચારના	૮	સંલેખનાના	૫	પંચાચારના ઉદ્ધ કુલ ૮૮
તપાચારના	૧૨	કર્માદાનના	૧૫	અતિચાર હોય છે.
વીર્યાચારના	૩			
૩૬		૮૫=૧૨૪		

પોતાના જીવનની પવિત્રતા માટે ઉપયોગી કેટલાક સામાન્ય નિયમો

૧. હું બાર પ્રતો ધારણ કર્યા પછી જ સંઘમાં દ્રસ્તી, પ્રમુખ અને મંત્રી થઈશ.
૨. હું ઉધામજીના (ધી બોલીના) પેસા સંઘે નક્કી કરેલી મુદ્દત પહેલાં ભરી દઈશ.
જૈન સાઇટ
JAIN SITE .com
૩. પથાશક્તિ સદાચારોનું ગ્રહણ અને પાલન કરીશ.
૪. હું રાત્રે સૂતાં પહેલાં “સંધ્યારા પોરિસિ”નો પાઠ બોલીશ. અને તેનો અર્થ વિચારીશ.
૫. હું રાત્રે સૂતાં પહેલાં “વંદામિ, મિશ્શામિ, ખામેમિ” ઈત્યાદિ પાઠ બોલીશ.
૬. હું પર્યુષજી પર્વમાં દરરોજ વ્યાખ્યાન સાંભળીશ, પ્રતિકમજા કરીશ. તથા અન્ય દિવસોમાં પજ યથાશક્તિ સાંભળવાનો ઉધમ કરીશ.
૭. કોઈની પજ સાથે અણાબનાવ થયો હશે તો સંવચ્છરી પ્રતિકમજા કરતાં પહેલાં મિશ્શામિ દુક્કડ માગીશ અને આપીશ.
૮. હું મારા લગ્નનાં ૨૫/૫૦ વર્ષની ઉજવણી કરીશ નહિ.

૮. હું મારા જન્મદિવસ (બર્થ-ડે)ની ઉજવણી આરંભ-સમારંભથી કરીશ નહિ. પરંતુ પ્રભુની પૂજા ભણાવવા દારા, અંગરચના કરવા દારા, તપ કરવા દારા અને પાઠશાળાના બાળકોને પ્રભાવના કરવા દારા ઉજવીશ.
૯૦. હું મારા પોતાના દ્વયથી ભગવાનની પૂજા કરીશ.
૧૧. ચોવીસે તીર્થકર ભગવાનના કલ્યાણકોમાં યથાશક્તિ તપ અને નવકારવાળી ગણીશ. બધાં કલ્યાણકોમાં નહિ જ બને તો પોષ દસમી અને મહાવીર પ્રભુના કલ્યાણકોમાં અવશ્ય કરીશ.
૧૨. હું ફટાકડા-બોંબ વિગેરે દ્રાર્ઘાનું ઝોડીશ નહિ.
૧૩. દર વર્ષ.....૨૫મ સાધુ-સાધીછની વૈયાવચ્ચમાં, સાધ્યમિક ભક્તિમાં, અનુકૂળપામાં, ધર્મના શુલ્કાર્થમાં ખરીશ.
૧૪. પક્ષીઓને ચંદ્ર આપવી, જાયોને વાસ ખવરાવવું, ફૂતરાને રોટલા આપવા, દીન-દુઃખી-દરિદ્રી ઉપર ફૂપા કરવી, પાડીની પરબ બંધાવવી ઈત્યાદિ અનુકૂળપાવાળાં પરોપકારનાં કાર્યો યથાશક્તિ કરીશ.
૧૫. હું મારા પરિચિત ભિત્રોને માંસભોજન, મહિરાપાન, દીંગાનું સેવન અને બીયરપાન જેવાં પાપકાર્યો ન કરવા સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ.
૧૬. લીધેલા આ બધા નિયમો બરાબર પાળીશ. ભૂલ થશે તો પ્રાયશ્ચિત લઈશ.

૧૭. M. C.ના સમયમાં રસોઈ કરવાનું કામ, સંતોને વહોરાવવાનું કામ, માટિરે જવાનું અને દર્શન-પૂજનાદિનું કામ, પુસ્તકો વાંચવાનું કે સ્પર્શ કરવાનું કામ ઈત્યાદિ કરીશ નહિ. શાસ્ત્રની આજ્ઞાને બરાબર પાળીશ.
૧૮. જૈન તરીકે ન છાજે (ન શોભે) તેવાં કાર્યો જેમ કે કઠલખાનાં કરવાં કે મત્સ્યોદ્યોગ કરવો. ઈત્યાદિ પાપધંધા કરીશ નહિ.
૧૯. પ્રતિવર્ષમાં ૧ તીર્થયાત્રા કરીશ. કુટુંબને કરાવીશ.
૨૦. હું મારા કુટુંબને શક્ય બની શકશે તેટલું ધર્મ-સંસ્કારોથી પરિચિત રાખીશ. **જૈન સાઇટ**
૨૧. કમાણીનો.....અમુક ડિસ્ટો પરોપકારના કાર્યોમાં વાપરીશ.
૨૨. દ્વિવસમાં ઘરનાં કામકાજ અને ધંધાના કામકાજ કરતાં બાકી બચતા સમયમાં ધાર્મિક પુસ્તકોનું વાંચન કરીશ.
૨૩. સંઘ અને સમાજનાં કાર્યોમાં સાથ-સહકાર આપીશ. વિરોધ અને વાંધા-વચકા નાંખીશ નહિ. ખોટું કરનારને સમજાવીશ.
૨૪. આડોશ-પાડોશની સાથે અને પરિચિત વ્યક્તિઓ સાથે પ્રેમપૂર્વક વર્તન કરીશ. કલેશ અને કડવાશ કરીશ નહિ.
૨૫. ઉપરોક્ત નિયમોવાળી આ મારી બુક દરરોજ એકવાર અવશ્ય વાંચીશ.

ગુરુવંદનની વિધિ

૧. પહેલાં ઉભા થઈ બે ખમાસમજા દેવાં.
૨. ત્યારબાદ ઉભા રહી ઈચ્છાકાર સૂત્રનો પાઠ બોલવો.
(આચાર્ય ભગવંત અથવા પદ્ધત સાથું હોય તો ઉભા થઈ એક ખમાસમજા દેવું.)
૩. પછી ઉભા રહી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન् ! અભ્યુહિઓમિ અભિભંતર દેવસિઅં ખામેઉ ? ઈચ્છા ખામેમિ દેવસિઅં, આટલુની બોલ્યા બાદ જમજો હાથ જમીન પર સ્થાપી ડાબો હાથ મુખ પાસે રાખી બાકીનો અભ્યુહિઓ પૂર્ણ બોલવો.
૪. પછી ઉભા થઈ એક ખમાસમજા દેવું.

સથારે “રાઈ” શબ્દ અને બપોરે બાર વાગ્યા પછી દેવસિ શબ્દ બોલવો. બંને સાથે ન બોલાય.

યૈત્યવંદનની વિધિ

પ્રથમ ઈરિયાવહીયા કરવા તે આ પ્રમાણે-

ઈરછામિ ખમાસમણો! વંદિઉ જાવણીજજાએ
નિસીહિઆએ મત્યઅણ વંદામિ એમ ખમાસમણું આપવું.

ભાવાર્થ : આ સૂત્ર દ્વારા દેવાધિદેવ પરમાત્માને તથા
પંચમહાક્રતથારી સાથું ભગવંતોને વંદના થાય છે.

પછી ઉલાં થઈને નીચે મુજબ બોલવું.

ઈરછાકારેણ સંદિસહૈલગવન्! ઈરિયાવહિયં
પદિકુકમામિ? ઈરછિં, ઈરછામિ પદિકુકમિઉ. ૧.
ઈરિયાવહિયાએ વિરાહણાએ. ૨. ગમણાગમણો. ૩.
પાણકકમણો, બીયકુકમણો, હરિયકુકમણો, ઓસા-ઉત્તિંગ-પણગ-
દગમણી-મકડાસંતાણા સંકમણો. ૪. જે મે જીવા વિરાહિયા.
૫. એગિંદિયા, બેઈંદિયા, તેઈંદિયા, ચઉરિદિયા, પંચિંદિયા.
૬. અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંઘણીયા,
પરિયાવિયા, કિલામિયા, ઉદ્વિયા, ઠાણાઓ ઠાણાં સંકામિયા,
જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ હુકુકુડ. ૭.

ભાવાર્થ : આ સૂત્રથી આપણા વડે હાલતાં-ચાલતાં જે
કોઈ જીવોની જાણતાં અજાણતાં વિરાધના થઈ હોય કે પાપ
લાગ્યું હોય તે દૂર થાય છે.

તસ્સ ઉત્તરીકરણેણ, પાયચિત્તકરણેણ, વિસોહી-કરણેણ,
વિસલ્લીકરણેણ, પાવાણંકમાણંનિંધાયણકુએ, ઠામિકાઉસ્સજાં.

ભાવાર્થ : આ સૂત્ર દ્વારા ઈરિયાવહિયં સૂત્ર બોલવા દ્વારા હળવાં થયેલાં પાપોની વિશેષ શુદ્ધિ થાય છે.

અન્નત્ય સૂત્ર

અન્નત્ય ઉસસિએણાં નીસસિએણાં ખાસિએણાં છીએણાં જંમાઈએણાં ઉડુએણાં વાયનિસંગેણાં ભમલીએ પિતામુચ્છાએ ૧. સુહુમેહિ અંગસંચાલેહિ, સુહુમેહિ ખેલસંચાલેહિ, સુહુમેહિ દિહિસંચાલેહિ. ૨. એવમાઈએહિ આગારેહિ અભગ્ગો અવિરાહિઓ હુજ્જ મે કાઉસંગ્ગો. ૩. જાવ અરિહંતાણાં અગવંતાણાં નમુક્કારેણાં ન પારેમિ. ૪. તાવ કાયં ઠાણેણાં મોણેણાં જાણેણાં અપ્પાણાં વોસિરામિ. ૫. સાઇટ

ભાવાર્થ : આ સૂત્રમાં કાઉસંગ્ગના સોણ આગારોનું વર્ણન તથા કેમ ઉલા રહેવું તે બતાવેલ છે.

(પછી એક લોગસ્સનો ચેદેસુ નિમલયરા સુધીનો અને ન આવે તો ચાર નવકારનો કાઉસંગ્ગ કરવો. પછી પ્રગટ લોગસ્સ કહેવો. તે આ પ્રમાણે-)

લોગસ્સ સૂત્ર

લોગસ્સ ઉજ્જોઅગરે, ધમતિત્યથરે જિણે, અરિહંતે કિતાઈસરાં, ચઉવિસંપિ કેવલી. ૧. ઉસભમજિઅં ચ વંદે, સંભવમભિણાંદણાં ચ સુમઈ ચ, પઉમાપહું સુપાસાં, જિણાં ચ ચંદપ્પહું વંદે. ૨. સુવિહિ ચ પુષ્ટદંતં, સીઅલ સિજજંસ વાસુપુજજં ચ, વિમલમણાંતં ચ જિણાં, ધમાં સંતિ ચ વંદામિ. ૩. કુંથું અરં ચ મલિં, વંદે મુખિસુવ્યયં નમિજિણાં ચ, વંદામિ રિહુનેમિ, પાસં તહ વદ્ધમાણાં ચ. ૪. એવં મયે અમિથુઆ,

વિહુય-રયમલા પહીણા-જરમરણા, ચઉવીસંપિ જિષાવરા,
તિત્થયરા મે પસીયંતુ. ૫. કિત્તિય-વંદિય મહિયા, જે એ
લોગસ્સ ઉત્તમ સિદ્ધા, આરુગબોહિલાભં, સમાહિવરમુતમં
દિતુ. ૬. ચંદેસુ નિમ્મલયરા, આઈચ્યેસુ અહિયં પયાસયરા,
સાગરવર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭.

ભાવાર્થ : આ સૂત્રમાં ચોવીસ તીર્થકરોની નામપૂર્વક
સુનિ કરવામાં આવી છે.

પછી ત્રણ ખમાસમણાં આપવાં.

પછી ઊભા થઈને બે હાથ જોડીને ‘ઈચ્છા-કારેણ
સંહિસહ ભગવન્દુ! ચૈત્યવંદન કરું? ‘ઈચ્છં’ એમ કહેવું.

જૈન સાહિત્ય
પછી જમણો ઢીચણા જમીન ઉપર સ્થાપીને અને ડાબો
ઢીચણ ઊભો રાખીને “સકલકુશલવલ્લી” એ ગાયા બોલીને
ચૈત્યવંદન કહેવું. તે આ પ્રમાણે-જૈનમ જ્યતિ શાસનમ्

સકલકુશલવલ્લી-પુષ્પકરાર્વતમેધો,
દુરિતનિમિરભાનુ: કલ્પવૃક્ષોપમાનઃ;
ભવજલનિધિપોત: સર્વસમ્પત્તિહેતુ:;
સ ભવતુ સતતં વ: શ્રેયસે શાન્તિનાથ:
શ્રેયસે પાર્શ્વનાથ: ૧

સામાન્ય જિન ચૈત્યવંદન

તુજ મૂરતિને નિરખવા, મુજ નયણાં તલસે,
તુજ ગુણ ગણને બોલવા, રસના મુજ હરખે. ૧

કાયા અતિ આનંદ મુજ, તુમ યુગ પદ કરસે,
તો સેવક તાર્યા વિના, કહો કિમ હવે સરસે. ૨

ઓમ જાળીને સાહિબા એ, નેક નજર મોહે જોય,
જ્ઞાનવિમલ પ્રભુ સુનજરથી, તે શું જે નવિ હોય. ૩

જંકિં ચિ સૂત્ર

જ કિચિ નામતિત્યં, સર્ગે પાયાલિ માણુસે લોએ,
આઈ જિષાબિંબાઈ, તાઈ સવ્યાઈ વંદામિ. ૧

ભાવાર્થ : આ સૂત્ર દ્વારા નણો લોકમાં વિદ્યમાન તીર્થો
અને જિન પ્રતિમાઓને નમસ્કાર કરવામાં આવેલ છે.

નમુન્થુણં સૂત્ર

નમુન્થુણં, અરિહંતાણં, ભગવંતાણં. ૧. આઈ-ગરાણં,
તિત્યયરાણં, સયંસંભુદ્ધાણં. ૨. પુરિસુતામાણં, પુરિસ-સીહાણં,
પુરિસ-વર-પુડિઅાણં, પુરિસ-વર-ગંધ-હત્યીણં. ૩. લોગુતામાણં,
લોગ-નાહાણં, લોગ-હિઅાણં લોગ-પઈવાણં, લોગપજજો-
અગરાણં. ૪. અભયદ્યાણં, ચક્ખુદ્યાણં, મગગદ્યાણં,
સરઝદ્યાણં, બોહિદ્યાણં. ૫. ધર્મદ્યાણં, ધર્મહેસયાણં, ધર્મ-
નાયગાણં, ધર્મ-સારહીણં, ધર્મ-વર-ચાઉરંત ચક્કવહીણં. ૬.
અઘડિહ્ય-વરનાણં- દંસશધરાણં, વિયહૃ-છઉમાણં. ૭. જિષાણં,
જાવયાણં, તિત્રાણં, તારયાણં, બુદ્ધાણં, બોહયાણં, મુતાણં,
મોઅગાણં. ૮. સવ્યાનૂણં, સવ્યદરિસીણં, સિવ-મયલ-મરુઅ-
મણંત-મક્ખ્ય-મવ્યાબાહ-મપુણરાવિતિ- સિદ્ધિગઈ-નામધેયં,
ઠાણં સંપત્તાણં, નમો જિષાણં-જિઅભયાણં. ૯. જે અ અઈયા
સિદ્ધા, જે અ ભયિસંતિ ણાગએ કાલે, સંપઈ અ વહુમાણા,
સવ્યે તિવિહેણ વંદામિ. ૧૦.

ભાવાર્થ : આ સૂત્રમાં અરિહંત પરમાત્માના ગુણોનું વર્ણન છે. અને ઈન્દ્ર મહારાજા પ્રભુની સુત્રિ કરતી વખતે આ સૂત્ર બોલે છે.

જાવંતિ ચેષ્ટાઈ

જાવંતિ ચેષ્ટાઈ, ઉકે અ અહે અ તિરિઅ-લોએ અ;
સવ્વાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્ય સંતાઈ. ૧.

ભાવાર્થ : આ સૂત્ર દ્વારા ત્રણે લોકમાં રહેલી જિન પ્રતિમાળાઓને નમસ્કાર કરવામાં આવે છે.

અહીં એક ખમાસમણું આપવું.

ઈચ્છામિ ખમાસમણો જોવંહિની જાવણિજજાએ
નિસીહિઆએ મત્થાએણ વંદામિ.

જાવંત કેવિ સાહુ જાવંત શાસનમ्

જાવંત કેવિ સાહુ, ભરહેરવય-મહાવિદેહ અ;
સવ્વેસિં તેસિં પણ્ણાઓ, તિવિહેણ તિદેંડ વિરયાણ. ૧.

ભાવાર્થ : આ સૂત્રમાં ભરત, ઐરાવત અને મહાવિદેહ એમ ત્રણેય ક્ષેત્રમાં વિચરતાં સર્વ સાધુ-સાધીણ ભગવંતોને નમસ્કાર કરવામાં આવે છે.

(નીચેનું સૂત્ર ફક્ત પુરુષોએ બોલવું.)

નમોડહૃત्

નમોડહૃત-સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુભ્ય:

ભાવાર્થ : આ સૂત્રમાં પંચપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યો છે.

સ્તવન

આજ મારા પ્રભુજી! સામુ જુઓને, સેવક કહીને બોલાવો રે,
એટલે હું મન ગમતું પામ્યો, રૂઠાં બાલ મનાવો, મારા સાઈ રે. ૧.
પતિત પાવન-શરણાગતવત્સલ, એ જસ જગ મચાવો રે,
મન રે મનાવ્યા વિષા નહીં મૂકું, એહી જ મારો દાવો રે. ૨.
કબજે આવ્યા તે નહિ મૂકું, જિહાં લગે તુમ સમ થાવું રે,
જો તુમ ધ્યાન વિના શિવ લહીયે, તો તે દાવ બતાવો રે. ૩.
મહા ગોપ ને મહાનિર્યામક, એવાં એવાં બિરુદ્ધ ધરાવો રે,
તો શું આશ્રિતને ઉદ્ઘરતાં બહુ બહુ શું કહાવો રે. ૪.
જ્ઞાનવિભલ ગુરુનો નિધિ મહિમા, મંગલ એહી વધાવો રે,
અચલ અમેદપણે અવલંબી, અહોનિશ એહી દિલ ધ્યાવો રે. ૫.



જય વીયરાય ! જગ-ગુરુ ! હોઉ મમં તુહ પભાવઓ ભયવં!,
ભવનિવેઓ મગગાણુસારિયા ઠહફલસિદ્ધિ. ૧.
લોગ-વિરુદ્ધરચાઓ, ગુરજણા-પૂઆ પરત્યકરણાં ચ;
સુહ ગુરુ જોગો તત્વધણા-સેવણા આભવ-મખંડા. ૨.
વારિજજઈ જઈવિ નિઆણ બંધણાં વીયરાય ! તુહ સમએ,
તહવિ મમ હુજજ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણાં. ૩.
દુક્ખકુખઓ કમ્મકુખઓ, સમાહિ મરણાં ચ બોહિલાભો અ;
સંપજજઉ મહ એઅં, તુહ નાહ ! પણામ કરણોણાં. ૪.
સર્વ-મંગલ-માંગલ્યાં, સર્વ કલ્યાણ કારણાં;
પ્રધાનાં સર્વ ધર્માણાં, જૈન જ્યતિ થાસનમુ. ૫.

ભાવાર્થ : આ સૂત્રમાં પ્રલુ પાસે ઉત્તમ પ્રકારની પ્રાર્થના કરવામાં આવી છે.

(પદ્ધતી ઉલા થવું.)

અરિહંતચેદાણં સૂત્ર

અરિહંતચેદાણં કરેમિ કાઉસ્સગં. ૧. વંદશા-વત્તિઆએ, પૂઅણવત્તિઆએ, સક્કારવત્તિઆએ, સમ્માણ-વત્તિઆએ, બોહિલાભવત્તિઆએ, નિરુવસગવત્તિઆએ. ૨. સદ્ગાએ મેહાએ ધિઈએ ધારણાએ અણૂપ્યેહાએ વહૃમાણીએ ઠામિ કાઉસ્સગં. ૩.

ભાવાર્થ : આ સૂત્રમાં જ્યેં ચૈત્યવંદન કરતા હોઈએ તે દેરાસરની તમામ પ્રતિમાઓને વંદન કરવામાં આવે છે.



અન્નત્ય સૂત્ર

જેનમ જ્યતિ શાસનમ

અન્નત્ય ઉસસિઅણં, નિસસિઅણં, ખાસિઅણં, છીઅણં, જંભાઈઅણં, ઉકુઅણં, વાયનિસગોણં, ભમલીએ પિતામુખણાએ. ૧. સુહુમેહિ અંગ-સંચાલેહિ, સુહુમેહિ ખેલ-સંચાલેહિ, સુહુમેહિ હિંદુ-સંચાલેહિ. ૨. એવમાઈઅહિ આગારેહિ, અંલગુંગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગો. ૩. જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાયં, ઢાણેણં, મોણેણં, જાણેણં, અપ્યાણં વોસિરામિ. ૫.

હવે એક નવકારનો કાઉસ્સગ કરી પારીને

નમોડહીત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાહુભ્ય:

કહીને નીચે પ્રમાણે થોય (સ્તુતિ) કહેવી.

જ્ય જ્ય ભવિ હિતકર વીર જિનેશ્વર દેવ,
સુરનરના નાયક જેહની સારે સેવ,
કરુણા રસ કંદો વંદો આણંદ આણી,
ત્રિશલા સુત સુંદર ગુણમણિ કેરો ખાણી. ૧.

અને છેલ્લે ભાવપૂજાની પૂર્ણાંહૃતિ કરતાં...કરતાં નીચેની
ભાવવાહી સુંદર ભાવના ભાવવી.

આવ્યો શરણો તમારા, જિનવર કરજો આશ પૂરી અમારી,
નાવ્યો ભવપાર મારો, તુમવિષાજગતમાં સારલેકોણ મારી?;
ગાયો જિનરાજ આજે હર્ષ અધિકથી, પરમ આનંદ કરી,
પાયો તુમ દર્શ નારો, અવભય જ્ઞાનાં નાથ! સર્વ હમારી. ૧

ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો મારું છું દેવાધિદેવા,
સામું જુઓને સેવક જાણી, એવી ઉદ્યરતનની વાણી.
ઉપસર્ગાઃ કાયં યાનિત, છિદ્યાન્તે વિદ્યનવલ્લયઃ,
મનઃપ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે.

સર્વમંગલ માંગલ્યં, સર્વ કલ્યાણ કારણં,
પ્રધાનં સર્વ ધર્માણં, જૈનં જ્યતિ શાસનમ्.



પ્રભુજીની નવાંગી પૂજાના દુલ્હા

- અંગૂઠે - જળભરી સંપુટ પત્રમાં, યુગાલિક નર પૂજંત,
અધિબ ચરણ અંગૂઠે, દાયક ભવજળ અંત. ૧
- થીયણે - જાનુ બળે કાઉસગ્ગ રહ્યા, વિચર્યા દેશ-વિદેશ,
ખડા ખડા કેવળ લખું, પૂજો જાનુ નરેશ. ૨
- કંડે - લોકાંતિક વચને કરી, વરસ્યા વરસી દાન,
કરકંડે પ્રભુ પૂજાના, પૂજો ભવિ બહુમાન. ૩
- ખલે - માન ગયું દોય અંશથી, દેખી વીર્ય અનંત,
ભૂજા બળે ભવજલ તર્યાં, પૂજો ખંધ મહંત. ૪
- મસ્તકે - સિદ્ધ શિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત,
વસિયા તેણે કારણ ભવિ, શિર-શિખા પૂજંત. ૫
- કપાળે - તીર્થકર પદ પુષ્યથી, ત્રિલુલન જન સેવંત,
ત્રિલુલન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જ્યવંત. ૬
- કંઠે - સોળ પહોર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુળ,
મધુરધ્વનિ સુરનર સુણે, તિણે ગળે તિલક અમૂલ. ૭
- હદ્યે - હદ્ય કમલ ઉપશમ બળે, બાણ્યા રાગ ને રોષ,
હિમ દહે વન ખંડને, હદ્ય તિલક સંતોષ. ૮
- નાભિમણે - રત્નત્રથી ગુણ ઉજળી, સકળ સુગુણ વિશ્વામ,
નાભિ કમળની પૂજાના, કરતાં અવિચળ ધામ. ૯
- ઉપદેશક નવ તત્ત્વના, તીણાં નવ અંગ જિણાંદ,
પૂજો બહુ વિધ ભાવથી, કહે શુલ્વવીર મુણાંદ.



પરમાત્માની અષ્ટપ્રકારી પૂજાના દુહા

૧. જળપૂજા

નમોડહેતુ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુત્યઃ

(આ સૂત્ર ફક્ત પુરુષોએ જ દરેક પૂજાની પહેલા બોલવું.)

(દૂધનો પ્રકાલ કરતી વખતે બોલવાનું)

મેરુ શિખર નવરાવે, હો સુરપતિ મેરુ શિખર નવરાવે,
જન્મકાળ જિનવરજી કો જાણી, પંચરૂપ કરી આવે. હો સું ૧
રત્ન પ્રમુખ અડજાતિના કળશા, ઔષધિ ચૂરણ મિલાવે,
ક્ષીરસમુદ્ર તીર્થોદક આણી, સાત્ર કરી ગુણગાવે. હો સું ૨
ઓણી પેરે જિન પ્રતિમાંકો નવજી કરી, બોધિબીજ માનું ભાવે,
અનુક્રમે ગુણ રત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ પાવે. હો સું ૩

જળપૂજાનું રહસ્ય

પ્રકાલ પ્રભુનો થાય અને કર્મમલ આપણો દૂર થાય

(પાણીનો પ્રકાલ કરતી વખતે બોલવાનું)

જળપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ,
જળપૂજા ફળ મુજ હોજો, માંગો એમ પ્રભુ પાસ.....

જ્ઞાન કળશ ભરી આત્મા, સમતારસ ભરપૂર,
શ્રી જિનને નવરાવતાં, કર્મ થાય ચકચૂર.

ॐ હ્રી^३ શ્રી^३ પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ
નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય= જલં યજામહે સ્વાદા.

૨. ચંદનપૂજા

ચંદનપૂજાનું રહસ્ય

આ પૂજા દ્વારા આપણો આત્મા ચંદન જેવો શાંત અને શીતલ બને.

શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતળ પ્રભુ મુખ રંગ,
આત્મ શીતળ કરવા ભણી, પૂજો અરિછા અંગ.

ॐ હ્રીं શ્રીं પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-
મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચંદનં યજામહે સ્વાહા.

સુખડથી વિલેપન-પૂજા કરવી અને પછી કેસરથી નવે
અંગે પૂજા કરવી. નખ કેસરમાં ન બોળાય અને નખ પ્રભુને
અડે નહિ તે ધ્યાન રાખવું

૩. પુષ્પપૂજા

પુષ્પપૂજાનું રહસ્ય

આ પૂજા દ્વારા આપણું છુવન પુષ્પની જેમ
સુગંધિત બને અને સદગુણોથી સુવાસિત બને.

સુરલિ અખંડ કુસુમગ્રહી, પૂજો ગત સંતાપ,
સુમ-જંતુ ભવ્ય જ પરે, કરીયે સમકિત છાપ.
પાંચકોડીના ઝૂલ્ફું વિધ્યામ્યા દેશ અઢાર,
રાજા કુમારપાણનો, વલ્યું જય-જયકાર.

ॐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ
નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા.

સુંદર, સુગંધવાળા અને આખંડ પુષ્પો ચઢાવવા, નીચે
પડેલા તથા વાસી પુષ્પો ચઢાવવા નહિ.

૩. ધૂપપૂજા

ધૂપપૂજાનું રહસ્ય

આ પૂજા દ્વારા જેમ ધૂપની ઘટા ઉંચે જાય, તેમ
આપણો આત્મા ઉચ્ચ ગતિની પ્રાપ્તિ કરે.

ધ્યાન ઘટા મગટાવીયે, વામનયન જિન ધૂપ,
મિશ્છત દુર્ગંધ દૂરે ટળે, મગટે આત્મ-સ્વરૂપ.

અમે ધૂપની પૂજા કરીએ રે, ઓ મનમાન્યા મોહનજી.

અમે ધૂપ ઘટા અનુસરીયે રે, ઓ મન માન્યા મોહનજી.

પ્રભુ નહિ કોઈ તમારી તોલે રે, ઓ મન માન્યા મોહનજી.

પ્રભુ અંતે છે શરણ તમારું રે, ઓ મન માન્યા મોહનજી.

પ્રભુ તમે તર્યા અમને તારજો રે, ઓ મન માન્યા મોહનજી.

ॐ ઈં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-
મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપ યજામહે સ્વાહા.

ગભારાની બહાર પ્રભુજીની ધૂપપૂજા કરવી. ધૂપ પૂજા
શુદ્ધ અને સુગંધી ધૂપ વડે કરવી.

૪. દીપકપૂજા

દીપકપૂજાનું રહસ્ય

આ પૂજા દ્વારા મારા આત્માના અજ્ઞાનરૂપી અંધકારનો
નાશ થાઓ અને કેવળજ્ઞાનરૂપી દીપકનો પ્રકાશ થાઓ.

દવ્ય દીપ સુવિવેકથી, કરતાં હુંખ હોય ફોક,
ભાવમદીપ પ્રગટ હુંએ, ભાસિત લોકાલોક.

ॐ ઝીઁ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-
મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દીપં યજામહે સ્વાહા.

પુરુષોએ પ્રભુજીની જમણી બાજુએ ઉભા રહી અને
સ્ત્રીઓએ પ્રભુજીની ડાબી બાજુ ઉભા રહીને દીપક પૂજા (ધૂપપૂજા
વિરોધ) કરવી.

૬. અક્ષતપૂજા

અક્ષતપૂજાનું રહસ્ય સાઇટ

અજન્મા થવાની પૂજા એટલે અખંડ અક્ષત પૂજા.
શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવત્ત વિશ્વાલ,
પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકલ જંજાલ.

ॐ ઝીઁ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-
મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતં યજામહે સ્વાહા.

સાથીઓ કરતી વખતે ભાવવાના હુંદા

અક્ષત પૂજા કરતાં થકાં, સફલ કરું અવતાર,
કણ માંગુ પ્રભુ આગળે, તાર તાર મુજ તાર. ૧
સાંસારિક ફલ માંગીને, રજડાચો બહુ સંસાર,
અષ્ટ કર્મ નિવારવા માંગુ મોકષફળ સાર. ૨
ચિહું ગતિ બ્રમજા સંસારમાં, જન્મ મરજા જંજાળ,
પંગમગતિ વિદ્ધા જીવને, સુખ નહિ ત્રિહું કાળ. ૩

દર્શન-શાન-ચારિતાના, આરાપુનથી સાર,
સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ શ્રીકાર. ૪

૭. નૈવેદ્યપૂજા

નૈવેદ્યપૂજાનું રહસ્ય

આ પૂજા દ્વારા અનંતકાળની મારી આહારસંજ્ઞાનો
નાશ થાઓ અને અણાહારી પદની પ્રાપ્તિ થાઓ.

આણાહારી પદ મેં કર્યા, વિગળ ગઈ અનંત,
દૂર કરી તે દીજાએ, અણાહારી શિવ સંત.
ન કરી નૈવેદ્ય પૂજના, ન ધરી ગુરુની શીખ,
લેશે પરભવે અશાત્તા, ઘર ઘર માંગશે ભીખ.

ॐ હ્રીं શ્રીं પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-
મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય નૈવેદ્યં યજમહે સ્વાહા.

સાધિયા ઉપર સાકર, પતાસા અને ઉત્તમ મીઠાઈ
ઘરની સુદુ બનાવેલી ચડાવવી. પીપર, ચોકલેટ મૂકાય નહિ.

૮. ફળપૂજા

ફળપૂજાનું રહસ્ય

આ પૂજા દ્વારા મને શ્રેષ્ઠ એવા મોક્ષકળની પ્રાપ્તિ થાઓ.

ઈન્દ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગ,
પુરુષોત્તમ પૂજા કરી, માંગે શિવકળ ત્યાગ.

ॐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-
મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ફલં યજામહે સ્વાદા.

શ્રીકણ, બદામ, સોપારી અને પાકાં ઉત્તમ ફળો
સિદ્ધશિલા ઉપર મૂકવા.

ચામરપૂજાનો દુલ્હો

બે બાજુ ચાર ઢાળો, એક આગળ વજ્ઞ ઉલાળે,
જઈ મેરુ ધરી ઉત્સંગે, ઈન્દ્ર ચોસઠ મળીયા રંગે,
પ્રભુ પાસનું મુખું જોવા, લવોલવનાં પાતિક ખોવા.

દર્પણપૂજાનો દુલ્હો

પ્રભુ દર્શન કરવા ભાડી, દર્પણ પૂજા વિશાલ.
આત્મ દર્શનથી જુએ, દર્શન છોય તત્કાલ.



જેનમ् જ્યતિ શાસનમ्

પૂજાવિધિ સમાપ્ત

સામાયિક લેવાની વિધિ

સામાયિક કરવામાં જોઈતી વસ્તુઓ

૧. સીવ્યા વિનાના શુદ્ધ વસ્ત્રો, ૨. કટાસમણું, ૩. મુહુપત્તિ, ૪. સાપડો, ૫. પુસ્તક, ૬. ચરવળો, ૭. ધડી, ૮. નવકારવાળી.
૧. મ્રથમ શુદ્ધ વસ્ત્રો પહેરવાં, પછી ચરવળાથી જગ્યા પૂંજી સ્થાપનાં સ્થાપવા માટે સાપડા ઉપર પુસ્તક મૂકીને મુહુપત્તિ ડાબા હાથમાં રાખી જમણો. હાથ પુસ્તક સામે રાખીને નવકાર-પંચિદિય કહીને સ્થાપનાં સ્થાપવા.
૨. પછી એક ખમાસમણું દઈને ઈરિયાવાહિયં, તસ્સ ઉત્તરી, અન્નત્ય કહી એક લોગસસનો (ન આવડે તો ચાર નવકારનો) કાઉસસગ્ગ કરવો, કાઉસસગ્ગ પારીને (નમો અરિહંતાણં કહીને) ગ્રગટ લોગસ્સ બોલવો. ન પછી-
૩. ખમાસમણું દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન् ! સામાયિક મુહુપત્તિ પડિલેહું ? ઈચ્છં. કહીને મુહુપત્તિ પડિલેહવી.
૪. પછી એક ખમાસમણું દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્. સામાયિક સંદિસાહું ? ઈચ્છં, કહી એક ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્. સામાયિક ઠાઉ ? ઈચ્છં કહી બે હાથ જોડી એક નવકાર ગાળવો.
૫. પછી ઈચ્છાકારી ભગવન્ પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવશોશ્ચ. એમ કહી કરેમિ બંતે સૂત્ર ગુરુ કે વડિલ હોય તો તેમની પાસે બોલાવવું અથવા પોતે બોલવું. હ પછી એક ખમાસમણું દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્!

બેસણે સંદિસાહું?" ઈચ્છા, કહી એક ખમાસમણું દઈ.
 "ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં?" ઈચ્છા કહી
 એક ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજ્જાય
 સંદિસાહું? ઈચ્છા કહી ઈચ્છાં સંદિસહ ભગવન્. સજ્જાય
 કરું? ઈચ્છા, કહી બે હાથ જોડીને ત્રણ નવકાર ગણવા.

- પછી બે ઘડી અર્થાત્ અડતાલીસ (૪૮) મિનિટ સુધી સ્થિર આસને બેસી ધર્મધ્યાન કરવું. સ્વાધ્યાય કરવો. સામાયિકમાં સંસારની વાત ન થાય- સંસાર સંબંધી વિચાર પણ ન થાય.

શ્રી સામાયિક પારવાની વિધિ

- પ્રથમ એક ખમાસમણું દઈને ઈરિયાવહિયં, તરસ ઉત્તરી, અન્નત્ય કહી એક લોગસ્ અથવા ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સરગ કરવો. (નમો અરિહ્ંતાણ કહીને) કાઉસ્સરગ પારીને પ્રગટ લોગસ્ બોલવો.
- પછી એક ખમાસમણું દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહૃપત્તિ પડિલેહું? ઈચ્છા, કહીને મુહૃપત્તિ પડિલેછવી.
- પછી એક ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક પારું! એમ આદેશ માગવો પછી (ત્યાં ગુરુ હોય તો પુનન્વિ કાયબ્યં કહે ત્યારે) 'ધથાશક્તિ' કહી એક ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક પાર્યું? એમ કહી (ગુરુજી હોય તો આયારો ન મોતબ્બો કહે ત્યારે) તહેત્તિ' કહેવું. પછી જમણો હાથ ચરવળા અથવા કટાસણા ઉપર સ્થાપીને એક નવકાર ગણી સામાઈયવયજુતો સૂત્ર બોલવું.
- સ્થાપના સ્થાપેલ હોય તો જમણો હાથ સવળો રાખી એક નવકાર ગણી સ્થાપનાજી ઉત્થાપી લેવા.

દિવસનાં પચ્યકુખાણા

નવકારશીનું પચ્યકુખાણા

ઉગગએ સૂરે, નમુક્કારસહિઅં, મુહિસહિઅં પચ્યકુખાઈ (પચ્યકુખામિ) ચઉલ્લિંહંપિ આછારં-અસણાં, પાણાં, ખાઈમં, સાઈમં અનત્થણાભોગેણાં, સહસાગારેણાં, મહતરાગારેણાં, સંબ્યસમાહિવત્તિયાગારેણાં વોસિરઈ (વોસિરામિ).

પોરિસી-સાહુપોરિસી

ઉગગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસિં, સાહુપોરિસિં, મુહિસહિઅં પચ્યકુખાઈ (પચ્યકુખામિ), ઉગગએ સૂરે ચઉલ્લિંહંપિ આછારં અસણાં, પાણાં, ખાઈમં, સાઈમં અનત્થણાભોગેણાં, સહસાગારેણાં, પચ્યશકાલેણાં, દિસામોહેણાં, સાહુવધણેણાં, મહતરાગારેણાં, સંબ્યસમાહિવત્તિયાગારેણાં, વોસિરઈ (વોસિરામિ)

એકાસણું-બેઆસણું

ઉગગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસિં, સાહુપોરિસિં, મુહિસહિઅં, પચ્યકુખાઈ (પચ્યકુખામિ), ઉગગએ સૂરે ચઉલ્લિંહંપિ આછારં, અસણાં, પાણાં, ખાઈમં, સાઈમં, અનત્થણાભોગેણાં, સહસાગારેણાં, પચ્યશકાલેણાં, દિસામોહેણાં, સાહુવધણેણાં, મહતરાગારેણાં, સંબ્યસમાહિવત્તિયાગારેણાં વિગઈઓ પચ્યકુખાઈ (પચ્યકુખામિ), અનત્થણાભોગેણાં સહસાગારેણાં, લેવાલેવેણાં, ગિહત્થસંસહેણાં ઉક્ષિભતવિવેણાં, પુષ્યમદ્ધિઅણાં, પારિદ્વાવજીયા-

ગારેણાં મહતરાગારેણાં, સવ્વસમાહિવત્તિયાગારેણાં-એગાસણાં બિયાસણાં, પચ્ચસકુખાઈ (પચ્ચકુખામિ) તિવિહંપિ આણારે અસણાં, ખાઈમં, સાઈમં, અમત્થણાભોગેણાં સહસાગારેણાં, સાગારિયાગારેણાં, આઉટટાપસારેણાં, ગુરુઅભુદ્ધાણેણાં, પારિદ્વાવણિયાગારેણાં, મહતરાગારેણાં, સવ્વસમાહિવત્તિયાગારેણાં પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિત્યેણ વા, અસિત્યેણ વા વોસિરીઈ (વોસિરામિ).

(જો બિયાસણાનું પચ્ચકુખાણ કરવું હોય તો “બિયાસણાં” અને એકસણાનું પચ્ચકુખાણ કરવું હોય તો “એગાસણાં” પાઠ કહેવો.)

જૈન સાઇટ

આયંબિલ

ઉગગાએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસિં, સાહ્યપોરિસિં, મુહિસહિઅં, પચ્ચકુખાઈ (પચ્ચકુખામિ), ઉગગાએ સૂરે ચાલ્યિહંપિ આણારે, અસણાં, પાણાં, ખાઈમં, સાઈમં, અમત્થણાભોગેણાં, સહસાગારેણાં, પચ્ચમકાલેણાં, દિસામોહેણાં, સાહુવયણેણાં, મહતરાગારેણાં, સવ્વસમાહિવત્તિયાગારેણાં, આયંબિલ પચ્ચકુખાઈ (પચ્ચકુખામિ), અમત્થણાભોગેણાં સહસાગારેણાં, લેવાલેવેણાં, તિહત્થસંસહેણાં ઉક્કિમતાવિવેગેણાં, પારિદ્વાવણિયાગારેણાં મહતરાગારેણાં, સવ્વસમાહિવત્તિયાગારેણાં, એગાસણાં પચ્ચકુખાઈ (પચ્ચકુખામિ), તિવિહંપિ આણારે, અસણાં, ખાઈમં, સાઈમં, અમત્થણાભોગેણાં, સહસાગારેણાં, સાગારિયાગારેણાં, આઉટટાપસારેણાં, ગુરુઅભુદ્ધાણેણાં, પારિદ્વાવણિયાગારેણાં, મહતરાગારેણાં, સવ્વસમાહિવત્તિયાગારેણાં પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા,

અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિત્યેણ વા, અસિત્યેણ વા
વોસિરઈ (વોસિરામિ).

તિવિહાર ઉપવાસ

સૂરે ઉગગએ, અભ્યતાહું પચ્યક્ખાઈ (પચ્યક્ખામિ)
તિવિહંપિ આહાર, અસણાં, ખાઈમં, સાઈમં, અનત્થણાભોગેણાં,
સહસાગારેણાં, પારિકાવણિયાગારેણાં, મહતારાગારેણાં,
સવ્યસમાહિવત્તિયાગારેણાં પાણાહાર પોરિસિં, સાહપોરિસિં,
મુહિસહિયં પચ્યક્ખાઈ (પચ્યક્ખામિ) અનત્થણાભોગેણાં,
સહસાગારેણાં, પચ્યજાકાલેણાં, દિસામોહેણાં, સાહુવધણોણાં,
મહતારાગારેણાં, સવ્યસમાહિવત્તિયાગારેણાં, પાણાસ્સ લેવેણ વા,
અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિત્યેણ વા,
અસિત્યેણ વા વોસિરઈ (વોસિરામિ).

ચાઉચિહાર ઉપવાસ

સૂરે ઉગગએ, અભ્યતાહું પચ્યક્ખાઈ (પચ્યક્ખામિ),
ચાઉચિહં પિ આહાર, અસણાં, પાણાં, ખાઈમં, સાઈમં,
અનત્થણાભોગેણાં, સહસાગારેણાં પારિકાવણિયાગારેણાં,
મહતારાગારેણાં, સવ્યસમાહિવત્તિયાગારેણાં, વોસિરઈ (વોસિરામિ)

દેશાવગાસિક

દેશાવગાસિયં, ઉવભોગં, પરિભોગં, પચ્યક્ખાઈ
(પચ્યક્ખામિ), અનત્થણાભોગેણાં, સહસાગારેણાં મહતારા
ગારેણાં, સવ્યસમાહિવત્તિયાગારેણાં, વોસિરઈ (વોસિરામિ)

સાંજના પર્યક્ખાણા

૧. પાણહારનું પર્યક્ખાણા

(તિવિહાર ઉપવાસ-આયંબિલ-
એકાસણા-બિયાસણાવાળાએ લેવાનું)

પાણહાર, દિવસચરિમં, પર્યક્ખાઈ (પર્યક્ખામિ),
અનત્થણાભોગેણાં, સહસાગારેણાં, મહત્તરાગારેણાં,
સવ્યસમાહિવત્તિયાગારેણાં વોસિરઠ (વોસિરામિ).

૨. ચઉલિહારનું પર્યક્ખાણા

દિવસચરિમં પર્યક્ખાઈ (પર્યક્ખામિ), ચઉલિહંપિ આહાર,
અસણાં, પાણાં, ખાઈમં, સાઈમં, અનત્થણાભોગેણાં, સહસાગારેણાં,
મહત્તરાગારેણાં, સવ્યસમાહિવત્તિયાગારેણાં વોસિરઠ (વોસિરામિ).

૩. તિવિહારનું પર્યક્ખાણા

દિવસચરિમં પર્યક્ખાઈ (પર્યક્ખામિ), તિવિહંપિ આહાર,
અસણાં, ખાઈમં, સાઈમં, અનત્થણાભોગેણાં, સહસાગારેણાં,
મહત્તરાગારેણાં, સવ્યસમાહિવત્તિયાગારેણાં વોસિરઠ (વોસિરામિ).

૪. દુવિહારનું પર્યક્ખાણા

દિવસચરિમં પર્યક્ખાઈ, દુવિહંપિ આહાર, અસણાં,
ખાઈમં, અનત્થણાભોગેણાં, સહસાગારેણાં, મહત્તરાગારેણાં,
સવ્યસમાહિવત્તિયાગારેણાં વોસિરઠ (વોસિરામિ).

ફફફફફ

શ્રાવક કર્તવ્યની દુંક સમજ

(શ્રી જિનહર્ષસૂરીધરજીની રચેલી શ્રી શ્રાવક કરણીની સજ્જાય ઉપરથી સાર રૂપે)


(જેમાં સવારથી સાંજ સુધીનાં છવન પર્યતનાં કર્તવ્યોનો સમાવેશ કરેલો છે.)

૧. હે શ્રાવક ! પાછલી રાત ચાર ઘડી બાકી રહેતાં ઊઠીને ભવસમુદ્રથી પાર કરનારા શ્રી નવકાર મંત્રનું નિરંતર સ્મરણ રાખજો.
૨. હે શ્રાવક ! તારો દેવ કોણ ? ગુરુ કોણ ? ધર્મ શું ? કુળના કૃત્યો શા છે ? અને તારો ધંધો શું છે ? તેનો વિચાર કરજો.
૩. હે શ્રાવક ! શુદ્ધ ચિત્ત નિરંતર સામાયિક કરજો. ધર્મબુદ્ધિ રાખજો અને રાત્રિનાં પાપની આલોચના નિમિત્તે રાઈ પ્રતિકમણ કરજો. જેનમ् જ્યતિ શાસનમ्
૪. હે શ્રાવક ! શક્તિ પ્રમાણે પચ્ચકુખાણ લેજો, જિન આજ્ઞા પાળજો. અને પ્રભુના ગુડા યાદ કરનાર સ્તવન સજ્જાયાદિ ભાણજો.
૫. હે શ્રાવક ! ચૌદ નિયમો ધારણ કરજો, જીવદ્યા પાળજો, દેરાસર જઈ પ્રભુ દર્શન, પૂજન આદિ કરજો.
૬. હે શ્રાવક ! ઉપાશ્રયે જઈ ગુરુવંદન કરજો, એકચિતો વાખ્યાન સાંભળજો અને દોષ રહિત ખપતો આહાર સાધુઓને વહોરાવજો.
૭. હે શ્રાવક ! સાધર્મિકનું સગપણ જગતમાં અધિક માનજો, સ્વામિવાત્સલ્ય કરજો, દુઃખી-દીન અને અંગહીનજનો પર દ્યા રાખજો.

૮. હે શ્રાવક ! સંપત્તિ પ્રમાણે દાન આપજે. મુરળીની સાથે ગર્વ ન કરજે, નામ બનજે, ધર્મના નિયમો ગુરુ પાસેથી ધારણ કરજે, ધર્મ ન વીસરતો.
૯. હે શ્રાવક ! શદ્ધ, નિર્દોષ ધંધો કરજે, ઓછું આપવાનો અને વધારે લેવાનો ત્યાગ કરજે, કૂડી સાક્ષી ન પૂરજે અને જુદાણું સંદર્ભ ત્યાગજે.
૧૦. હે શ્રાવક ! બત્તીશ અનંતકાય, બાવીશ અભક્ષયનો સર્વથા ત્યાગ કરજે, કાચાં કુણાં ફલ ન ખાજે.
૧૧. હે શ્રાવક ! રાત્રિ ભોજનના અસંખ્ય દોષો છે. એમ સમજજે અને તેનો જરૂરાજરૂર ત્યાગ કરજે. સાળખાર, સાબુ, લોહું અને લોહાનો સામાન, ગળી, મધ અને મહુડાં વેચવાનો (વેપાર કરવાનો) જૈન શાસ્ત્રમાં નિષેધ કરેલ છે માટે તેનો વેપાર ન કરજે.
૧૨. હે શ્રાવક ! રંગનો પાસ કરાવવામાં ઘણા દોષો છે, તેમજ પાણી પણ બજે વાર ગાળીને વાપરવું જોઈએ. અણાગળ પાણી કોઈ વાર પીજે નહિ.
૧૩. હે શ્રાવક ! સંખારાના જીવો યતનાપૂર્વક તેના સ્થાને પરઠવજે, લાકડાં-છાણાં ચૂલ્હામાં મૂક્તાં બરાબર તપાસજે, પાપ બને તેટલું છોડવા અને પુણ્ય પ્રાપ્ત કરવા તત્પર રહેજે.
૧૪. શ્રાવક ! પાણી ધીની પેઠે અને બને તેટલું ઓછું વાપરજે. વરસ્તો ધોવામાં પાણી ગાળીને વાપરજે, બ્રહ્મચર્ય બની શકે તેવી રીતે પાળજે, સધળાં પાપાદિ દોષોને દૂર કરજે.
૧૫. હે શ્રાવક ! પાપ ઉત્પન્ન કરનાર પંદર કર્માદાન શાસ્ત્રમાં કહેલાં છે તેનો ત્યાગ કરજે, અનર્થદંડ માથે ન લઈશ.

૧૬. હે શ્રાવક ! શુદ્ધ સમક્ષિત હૃદયમાં ધારણા કરજે. વચન વિચારીને બોલજે, ઉત્તમ ધર્મ કાર્યમાં દ્વય વ્યય કરજે અને પરોપકારનાં કૃત્યો કરજે.
૧૭. હે શ્રાવક ! તેલ, છાશ, ધી, દહીનાં ભાજન ખુલ્લાં ના મૂકીશ, બે અષ્ટમી, બે ચતુર્દશી અને સુદ પંચમી એ પાંચ તિથિમાં દળવા, ખાંડવાના આરંભના કાર્યો ન કરજે, ઢોંગ છોડીને શિયળ પાળજે.
૧૮. હે શ્રાવક ! સાંજે ચોવિહાર-ચારાહારનો ત્યાગ કરજે, દિવસના પાપની આલોચના કરજે, જેથી સઘણાં દુઃખ નાશ પામશે.
૧૯. હે શ્રાવક ! વળી છ આવશ્યક સંભાળજે, સંધ્યા પ્રતિકમણ કરજે “જિનેશ્વર દેવના ચરણોની ભવોભવ સેવા મળજો” એવી ભાવનાપૂર્વક ચારનાં શરણ ઈચ્છતો સાગારી અનશન આદરજે.
૨૦. હે શ્રાવક ! શત્રુજય તીર્થની યાત્રા કરવાના મનમાં વિચારો કરજે, તેમજ સમેતશિખર, આબુ, ગિરનાર આદિ તીર્થોની યાત્રાની ભાવના ભાવજે.
૨૧. હે શ્રાવક ! આ બધી શ્રાવકને કરવા યોગ્ય કિયાઓ છે. તેથી અષ્ટકર્મ, ભવોનો નાશ થાય છે. પાપ બંધન તૂટે છે. નબળાં પડે છે.
૨૨. હે શ્રાવક ! આ કિયાથી સુંદર દેવ વિમાન મળે છે. અંતે મોક્ષ સ્થાનની પ્રાપ્તિ જીવ મેળવી શકે છે. તો જિનહૃદ્વિજ્ય મહારાજની કહેલ દુઃખોને નાશ કરનારી આ શ્રાવકકરણીનો અભ્યાસ કરી તેમ વર્તવા પ્રયત્નશીલ રહેજે.

(સ્વાધ્યાય સમુચ્ચ્યમાંથી સાલાર)



ભાડે લીધેલું ઘર હોય, અને કોઇ
 કારણવશાત્ બે-ચાર માસ રહેવા ન જઈએ
 તથા મકાનનો ઉપયોગ ન કરીએ તો પણ
 ભાડું તો આપવું જ પડે. મકાનનો વપરાશ
 ભરે નથી કર્યો પણ સંબંધ ત્યજ્યો નથી.
 તે જ રીતે એવાં કેટલાય પાપો છે કે જે
 શ્રાવક-શ્રાવિકાના જીવનમાં કરાતાં નથી
 પરંતુ પચ્ચાખાણા ન લીધું હોવાથી ભાડાના
 મકાનની જેમ આશ્રવ તો ચાલુ જ રહે
 છે. આમ આશ્રવને રોકવા પચ્ચાખાણાં પૂર્બ
 જ ઉપયોગી અને અનિવાર્ય છે. શ્રાવક-
 શ્રાવિકાએ ઉત્તમ અને નિર્ભય જીવન
 જીવણ માટે સમ્યકૃત્પવૂર્વક શ્રાવક ધર્મના
 બાર પ્રતો સમજવા જોઈએ અને ઉચ્ચરવા
 જોઈએ. ચાલો આપણો પણ સમ્યકૃત્વ અને
 ભારપતો વિષે કેટલીક વાતો સમજુએ.....

દીરજલાલ ડાહાલાલ મહેતા

Bharat Graphics-Ahmedabad-1.
 Ph. : (079) 2134176, 2124723